

યોગ, સ્વાસ્થ્ય અને નૈતિક જીવન મૂલ્યોનું માસિક


# દિવ્ય જીવન



વાર્ષિક લવાજમ : રૂ. ૧૫૦/- ● વર્ષ - ૧૮ અંક - ૨ ફેબ્રુઆરી-૨૦૨૧

Postal Registration No. GAMC 1417/2021-2023 Valid up to 31-12-2023 RNI No. GUJGUJ/2003/15738

Published on 4th of every month and Posted on 5th of every month at PSO, Ahmedabad-2. Annual Subscription Rs.150/-



## દિવ્યતાનાં તેજસ્વી કેન્દ્રો

આપણો દિવ્યતાનાં તેજસ્વી કેન્દ્રો છી એ. તેથી આપણું જીવન દિવ્યતાની અવિરત અભિવ્યક્તિ, મન-વચન-કર્મથી ક્રિયાશીલ પ્રદર્શન બની રહેવું જોઈએ. આપણો જે કાંઈ કરીએ તે તથા આપણા જીવનની બધી પ્રવૃત્તિઓ દિવ્યતા પ્રદર્શિત કરે, આ માટે જ આપણું જીવન હોવું જોઈએ અને તો જ આપણું જીવન વિશ્વાસપાત્ર, યથાર્થ અને સત્ય ગણાય.

- સ્વામી શિવાનંદ



શ્રી દુઃખ ભંજન હનુમાન મંદિરનો ૧૫મો પાટોન્સવ શિવાનંદ આશ્રમ,  
અમદાવાદ. તા. ૨૬-૧-૨૦૨૧



મકર સંકાન્તિનાં પૂજય પર્વ ગો પૂજન-ગોવાળો સાથે સત્સંગ, રામપુર કંપો (ખેડબ્રહ્મા) તા. ૧૪-૧-૨૦૨૧



અયોધ્યાલુ ખાતે શ્રીરામભંદિર નિર્માણ હેતુ શિવાનંદ આશ્રમ,  
દિવ્ય જીવન સાંસ્કૃતિક સંઘની વિનમ્ર સેવા-સવા લાખ રૂપિયાનો  
ચેક અર્પણ (અમદાવાદ) તા. ૧૧-૧-૨૦૨૧



પવિત્ર શ્રી વાળીનાથ ધામના નૂતન નિર્વાચિત મહંતશ્રી  
જ્યરામગિરિલુ મહારાજની ચાદર વિધિ. તા. ૮-૧-૨૦૨૧

શિવાનંદ આશ્રમ, અમદાવાદમાં  
તા. ૧ ફેબ્રુઆરી ૨૦૨૧ થી યોગાસન વર્ગ  
નિયમિત ચાલુ થઈ ગયા છે.  
પ્રારંભિક (નવા શિખાઉ માટે)  
તા. ૧ થી તા. ૧૦ સવારે દ. ૧૫ થી ૭.૩૦  
તા. ૧૫ થી તા. ૨૫. સાંજે દ. ૩૦ થી ૭.૪૫ સુધી રહેશે.  
પ્રેક્ટિસ વર્ગ..સવારે દ. ૧૫ થી ૭.૧૫,  
૭.૦૦ થી ૮.૦૦, ૧૦.૩૦ થી ૧૧.૩૦  
૪.૦૦ થી ૫.૦૦ (ફક્ત બહેનો માટે)  
૬.૦૦ થી ૭.૦૦ નો વર્ગ.

### રેઠકી સેમિનાર

પહેલી ડિગ્રી : તા. ૧૩-૨-૨૦૨૧  
બીજી ડિગ્રી : તા. ૨૭-૨-૨૦૨૧  
સમય : ૮.૩૦ થી ૫.૩૦

સ્વતંત્ર ભારતના ઉરમા ગણતંત્ર દિવસ નિમિત્તે  
શિવાનંદ આશ્રમમાં ધ્વજવંદન અને પૂજય સ્વામી  
અધ્યાત્માનંદજી મહારાજનો રાષ્ટ્રને નામ સંદેશ (આ  
કાર્યક્રમનું Online પ્રસારણ કરવામાં આવ્યું હતું, તેનો  
લાભ ભારત ઉપરાંત અમેરિકા, કેનેડા, લંડન અને  
તાઈવાનના ભક્તોએ લીધો હતો. તા. ૨૬-૧-૨૦૨૧

# શ્રી સ્વામી શિવાનંદજી મહારાજની પ્રેરણાથી પ્રકાશિત દિવ્ય જીવન

વર્ષ : ૧૮

અંક : ૨

કેલ્લુઆરી-૨૦૨૧

સંસ્થાપક અને આધતંત્રી :  
ભ્રાહ્મીન શ્રી સ્વામી યાશવલ્લયાનંદજી  
(ડૉ. શિવાનંદ અધ્યાત્મ)

સંપાદક મંડળ :  
અધ્યક્ષ : શ્રી સ્વામી અધ્યાત્માનંદજી (તંત્રી)  
શ્રીમતી રૂપા મજમુહાર

તંત્રી : શ્રી સ્વામી અધ્યાત્માનંદજી  
દૈખ મોકલ્લવાનું સરનામું :  
શિવાનંદ આશ્રમ, જોધપુર ટેક્સી,  
અમદાવાદ - ૩૮૦૦૧૫.  
ફોન : ૨૬૮૬૧૨૩૪, ૨૬૮૬૨૩૪૫

મુખ્ય કાર્યાલય :  
'દિવ્ય જીવન' માર્કિન, તેજુ લાવાજમ :  
સ્વામી ચિદાનંદ સર્વજ્ઞવિશેવાનિપિ  
ઈટર પત્રવલાર અને મહામંત્રીનું કાર્યાલય :  
શ્રી યતોશભાઈ ટેલ્સાઈ  
ગુજરાત દિવ્ય જીવન સંધ  
શિવાનંદ આશ્રમ,  
જોધપુર ટેક્સી, સેટેલાઈટ માર્ગ,  
અમદાવાદ - ૩૮૦૦૧૫  
ફોન : ૨૬૮૬૧૨૩૪  
ટેલિફેક્સ : ૨૬૮૬૨૩૪૫

E-mail :  
[sivananda\\_ashram@yahoo.com](mailto:sivananda_ashram@yahoo.com)  
Website : <http://www.divyajivan.org>

**લાવાજમ**

ભારતમાં	લાવાજમ	લાવાજમ	લાવાજમ	લાવાજમ	લાવાજમ
વાર્ષિક	રૂ. ૧૫૦/-	રૂ. ૧૫૦૦/-	રૂ. ૧૫૦૦/-	રૂ. ૧૫૦૦૦/-	રૂ. ૧૫૦૦૦/-
(૧૫ વર્ષ માટે)					
પેટ્રોન લાવાજમ	રૂ. ૩૦૦૦/-				
ઇંટર્ન્યુકલ	રૂ. ૧૫/-				
વિદેશ માટે (એર મેરીલ)					
વાર્ષિક (એર મેરીલ)	રૂ. ૧૮૦૦/-				
શુભેચ્છક લાવાજમ	રૂ. ૧૫૦૦/-				
(૧૫ વર્ષ માટે) એક/દ્વારા (અમદાવાદ) દ્વારા					

૩૦

સર્વે બેદા યત્ત પદમામનનિ  
તપાશસિ સર્વાણિ ચ યદ્વ બદનિ ।  
યદિચ્છનો બહ્નાચર્ય ચરનિ  
તત્તે પદર સંગ્રહેણ જીવીસ્યોમિત્વેતત ॥

કઠોપનિષદ્દ - ૧૦:૨:૧૫

યમરાજ અહીં પરબ્રહ્મ પુરુષોત્તમને પરમ ગ્રાણ બતાવીને તેમના વાચક ઝેંકારને પ્રતીકરૂપે તેમનું સ્વરૂપ બતાવે છે. તેઓ કહે છે કે સમસ્ત વેદ જુદા જુદા પ્રકાર અને છંદથી જેમનું પ્રતિપાદન કરે છે, સંપૂર્ણતપ વગેરે સાધનોનું જે એકમાત્ર પરમ અને ચરમ લક્ષ્ય છે તથા જેને ગ્રાણ કરવાની હૃદ્યાથી સાધક નિષ્ઠાપૂર્વક બ્રહ્માચર્યનું અનુષ્ઠાન કર્યા કરે છે, તે પુરુષોત્તમ ભગવાનનું પરમતત્ત્વ હું તને સંકોપમાં બતાવું છું - તે છે '૩૦'; આ એક અંશર.

## શિવાનંદ વાણી

**શ્રદ્ધા અને સદ્ભાવ હોય તો કશું અશક્ય નથી**

પ્રકાશમાન આત્મા ! તમારી સામે પથરાયેલું આ વર્ષ તમારા માટે વિકાસ, સંસ્કૃતિ, આધ્યાત્મિકતા અને ઉત્કૃષ્ટ નિઃસ્વાર્થતા, ત્યાગ અને સેવાનાં ઉમદા જીવન કેળવવાની ઉર્ધ્વગમનની, આરોહણની સિડી બની રહો. તમે ઊંચાઈઓ સર કરીને, પેલી પાર દિવ્ય ચેતના, ભગવદ્ - ચેતના, દિવ્ય-સભાનાત્માં પ્રવેશો. દૂર દેખાતી ટોચ પર પહોંચવા માટે દરેક દિવસને, ઉપર જવા માટે આરોહણનો દિવસ બનાવો અને તમે હાલ જે સ્તરે છો તેનાથી ક્ષયાંક વધુ ઊંચે આવતા વર્ષે પહોંચો.

- સ્વામી શિવાનંદ

કેલ્લુઆરી - ૨૦૨૧નો દિવ્ય જીવનનો અંક

સૌજન્ય : શ્રીમતી પાતુલ - શ્રી વિજય જીજુલ

## અનુકૂળ

૧. કઠોપનિષદ્ધ	૩
૨. અનુકૂળ, તહેવાર સૂચિ	૪
૩. સંપાદકીય	૫
૪. મંત્ર-યોગસાધના	૭
૫. મન સમસ્યા બને તે માટે આપવામાં આવ્યું નથી	૮
૬. સાંખ્યનું સ્વરૂપ-૪	૧૧
૭. અહિસા, સત્ય અને પ્રભુ	૧૨
૮. પ્રેમનો સંગમ મહાત્મા ગાંધીજી	૧૩
૯. આહાર મનનું નિર્માણ કરે છે-ર	૧૪
૧૦. સ્વામી વિવેકાનંદ અને યુવાવર્ગ	૧૪
૧૧. રામાયણ હકીકત છે,	૧૬
વિદ્વાનોનું કથન છે.	
૧૨. નવી દુનિયામાં-૩	૧૮
૧૩. આધુનિક યુગનું ભાગ્યમ-૩	૨૦
૧૪. અચિત્ય અરુદ્ધેવ	૨૧
શ્રી સ્વામી શિવાનંદ-૨	
૧૫. ઘ્યાનસ્થ દર્શન:	૨૫
૧૬. તેચુ તુજ્હો અર્પણા, કયા લાગે ગેયા !	૨૬
૧૭. ઊં = $m^c$ ( $E = mc^2$ )	૨૮
૧૮. મારા પ્રસૂતર	૩૦
૧૯. ગોળ અને ખંડમાં શું કેર છે ?	૩૧
૨૦. વૃત્તાંત	૩૨

## તહેવાર સૂચિ

માર્ચ - ૨૦૨૧

૧. તિથિ (મહાવદ)	૫
૨. શ્રીનાથજી પાઠોત્સવ (નાથદાર)	૬
૩. શ્રી રામદાસજીયંતી	૭
૪. શ્રી સ્વામી દયાનંદ	૮
૫. સરસવીજીયંતી	૯
૬. વિજયા એકાદશી	૧૧
૭. પ્રદીપ પૂજા	૧૨
૮. મહાશિવરાંતી	૧૩
૯. દર્ઢાભાવાસ્ય (કાગજ સુદ)	૩૦
૧૦. શ્રી રામદાસ પરમહંસજીયંતી	૧૫
૧૧. હોળાએક ગ્રાંબ	૨૧
૧૨. આમલદી એકાદશી	૨૫
૧૩. પ્રદીપ પૂજા	૨૬
૧૪. પૂર્ણિમા, હોળી, હોળાએક સમાપ્ત (કાગજ વદ)	૨૮
૧૫. પુરોણી, વરંગોત્સવ	૨૯
૧૬. સંત તુકારામ બીજ	૩૦

૬૨ વર્ષની જેમ આગામી શૈક્ષણિક વર્ષ માટે વનવાસી વિદ્યાર્થીઓ માટે સવા લાખ નોટબુક પ્રસિદ્ધ કરવામાં આવનાર છે, જે માટે આર્થિક સહયોગ-દાન આપવા હાઇક વિશાળી.

### “અનુરોધ-અભિલાષા” ગ્રાહકોને :

- આપનું પત્રવ્યવહારનું સરનામું પિનકોડ સાથે સંપૂર્ણ હોય તે ટપાલ ખાતાના નવા નિયમો મુજબ અનિવાર્ય છે.
- સરનામું બદલો ત્યારે સરનામાની ચોકસાઈ માટે વિનંતી.
- આપનો ગ્રાહક નંબર નોંધો લેવા વિનંતી છે, જેથી અંકની પ્રાપ્તિ સંબંધી કોઈ પણ પત્રવ્યવહાર કરતી વેળા ગ્રાહક નંબરનો ઉલ્લેખ વહીવટી સરળતા સર્જ શકે છે.
- સામાન્યતા: દર માસની પાંચમી તારીખે અંક પ્રસિદ્ધ થયા બાદ તેની રવાનગીનું કામ શરૂ થાય છે. છતાં કોઈ ખાસ કારણોસર પ્રકારાનાની નિર્ધારિત તારીખના ૧૦ દિવસ વિન્દે પણ જો આપને અંક ન મળે તો સ્થાનિક ટપાલ ક્રોરીમાં તપાસ કર્મ બાદ વહીવટી કાર્યાલયને જણાવું. સિલકમાં હોયો તો બીજો અંક મોકલાશે.
- ‘દિવ્ય જીવન’ની સામગ્રી આપને ગમી હોય. તેથી હવે આપનાં પરિચિત વર્ણિઓમાં પણ તેની રસલાલા થાય અને ગ્રાહકવૃદ્ધિમાં આપનો નકલર સહયોગ અમને મળતો રહે તેવી અભિલાષા છે.
- અમદાવાદ સિવાયના ગ્રાહકોએ પોતાનું લવાજમ ડ્રાઇટ અગર મનીઓર્ડરથી જ મોકલવું.

### દિવ્ય સ્કુલિંગ

#### લક્ષ્ય

તમે આ માનવજીવનની યાત્રા શા માટે શરૂ કરી છે ? તમારું લક્ષ્ય શું છે ? સર્વોચ્ચ અને અશ્રીમ ડેતું છે : આત્મસાક્ષાત્કાર. આ જ તમારું લક્ષ્ય છે. આ માટે જ તમે આ યાત્રા શરૂ કરી છે. બીજી બધી બાબતો ગૌણ છે. મુખ્ય લક્ષ્યની સાથોસાથ તમે સેવા જેવી બીજી બાબતો કરી શકો.

- સ્વામી દિલાંદ

## સંપાદકીય

શ્રી સ્વામી અધ્યાત્માનંદજી

આ સંપાદકીય લખું છું ત્યારે શ્રીરામ મંહિર નિર્માણ અર્થે નિવિના પજીમાં યોગદાન આપવાનું એકત્ર કરવાનું અભિયાન ચાલુ થઈ ગયું છે. પ્રારંભ આપવા આદરશીય રાષ્ટ્રપતિ મહોદ્યથી થયો. હિવ્ય જીવન સાંસ્કૃતિક સંધ્યા, શિવાનંદ આશ્રમે પણ યત્કિચિત સેવા હૈ. સવા લાખનું વિનામ યોગદાન કર્યું. ભારત દેશ શ્રીરામ, શ્રીકૃષ્ણની ભૂમિનો દેશ છે. જેટલાં રામાયણનાં પાત્રો આપવી સંસ્કૃતિ અને સંસ્કાર સાથે એકરૂપ થયાં છે તેટલાં બીજી કોઈ પણ સંસ્કૃતિનાં પાત્રો ત્યાંની પ્રજ્ઞા સાથે તાદાત્મ્ય કેળવી શક્યાં નથી.

વાલ્મીકિનાં રામાયણ જેટલું બીજું કોઈ પણ મહાકાવ્ય ચારિત્ર્ય, પરસ્પર પ્રેમ, પિતૃભક્તિ, આતૃભાવ, ગુરુભક્તિ અને શત્રુ સાથે પણ યુદ્ધના મેદાન સિવાય મૈત્રીભાવની અદ્ભુત ભાવના સમાન ગ્રંથ નથી.

ऋગ્વાલ્મીકિ, શ્રીતુલસીદાસજી તામિલનાડુમાં કંબ રામાયણ અને બંગાળમાં કૃતિવાસનાં રામાયણ અતિરિક્ત અનેક નાના-મોટા ગ્રંથ રામકथા માટે લખાયા છે અને પુગોથી કથાકારો શ્રીરામચરિતને વર્ણવિતા આવ્યા છે.

શ્રીરામ ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારોનું ફદ્ય છે. ભારતીય આચાર વિચાર અને વ્યવહારોનો પ્રકાશ પથ છે. સત્ય, નિષ્ઠા, સદ્ગ્યાર અને સન્માતિના ચતુષ્યનો બેઝેડ નમૂનો એટલે શ્રીરામ. માટે જ તેને ભારતીય આચારસંહિતાનો આદર્શ માનવામાં આવે છે.

ભગવાન શ્રીવિષ્ણુના પ્રમુખ દશાવતાર અને નાના-મોટા ચોલીસ અવતાર થયા, પરંતુ શ્રીરામ અને શ્રીકૃષ્ણનાં માત્ર ભારતીયો જ નહીં, દેશ-પરદેશનાં ભક્ત ફદ્યની ધર્કન જેટલાં બન્યાં તેમ કોઈ પણ ધર્મ કે તેના ભસીછાઓ તેમના અનુયાયીઓ કે ભક્તોના ચાહકો બન્યાનથી.

શ્રીરામ મંહિરનું નિર્માણ આવનારી પેઢીઓ માટે

જીગૃત શિક્ષણ, શિક્ષા અને શ્રેષ્ઠ શિક્ષકનું કામ કરશે. એક આદર્શ પુત્ર, આદર્શ ભાતા, આદર્શ પતિ, આદર્શ ભિન્ન, આદર્શ ભક્ત અને આદર્શ શત્રુના એક જ વિગ્રહમાં દર્શન એટલે શ્રીરામ. શ્રીરામ એક પત્નીપ્રતા હતા. આજે જ્યારે આ લાખાઈ રહ્યું છે, સમાચાર છે, “માસ્ક પહેર્યા વગર સ્કૂટર પર જતી યુવતીને દંડ થયો. યુવતીનું વર્તન બેદૂદું હતું. P.S.I. પણ અકણાયો હતો. યુવતીએ ટ્રાફિક પોલીસનો ફોટો પાડ્યો. P.S.I. એ તેનો ફોન નંબર લીધો. પછી ગુડમોર્નિંગ, ગુડનાઈટના વોટ્સએપ ચાલ્યા. યુવતીએ પોતાના પતિ સાથે છૂટાછેડા લીધા. આ P.S.I.ને પરણી ગઈ. પાછળથી ખબર પડી કે તે પરણોલો હતો. યુવતીને ગામડાંમાં સાસુનો ત્રાસ હતો. પછી જેમ થાય છે તેમ આત્મહત્યા વગરે વગરે, પરંતુ જ્યાં શીલ નથી, લજજા નથી, મર્યાદાનથી ત્યાં આવું થવાનું જ.

એક શિક્ષિકા ઓટોરિક્ષામાં શાળાએ જતી. રિક્ષાચાલક સાથે મૈત્રી થઈ. શારીરિક સંબંધો થયા. પછી ખબર પડી કે તે પરણોલો છે, પછી તે શિક્ષિકાએ જેર ખાંધું. ખાનગી હોસ્પિટલમાં અઠવાડિયું રહી. ત્યાં ડેક્કટર સાથે પ્રેમસંબંધ બંધાયો. એક હિવસ ડેક્કટરનું અપહરણ થયું. તેઓ બંને શિવાનંદ આશ્રમમાં મહાદેવના મંહિર પાસે બાંકડા ઉપર દરરોજ બેસતાં. અપહરણ થયું ત્યારે સમાચારપત્રોમાં મોટા અક્ષરોએ છ્યાંયું “શિવાનંદ આશ્રમનાં પ્રેમી પંખીડાંઓનું અપહરણ”.

શ્રીરામનું દામ્પત્યજીવન એક આદર્શ ગૃહસ્થાશ્રમનું છે. તેને જ્ઞાનનું જ પડશે. સાવધાન થઈએ. રામ વ્યક્તિ નથી. રામ વિચાર છે. રામ જનજીવનની ધરાધૂરાના પાયાનો પથર છે. આપણા જીવનની ભવ્ય અણાલિકાઓની આધારશિલા છે. શ્રીરામ મર્યાદા પુરુષોત્તમ છે. માટે રામાયણને જીવંત

રાજવું જ પડશે. હોલિવૂડ, બોહિવૂડ અને ડિકેટરોને આપણા આદર્શન રાખી શકાય. તે સૌ સ્વકીય સ્થાને શ્રેષ્ઠ હોવા છતાં ‘આદર્શ’ કેન્દ્રે કોઈ રામની તુલનામાં આવી શકશે નહીં. શ્રીરામ કથાનો મહિમા બાળી, કંબોડિયા, જીવા, સુમાત્રા, થાઇલેન્ડમાં ખૂબ જ છે. માટે શ્રી રામ મંદિર નિર્માણ હેતુ ઉદારતાથી દાન આપીએ. આ દાન નથી, કર્તવ્ય છે. આપણા ભવિષ્યના જીવનનો અંધકાર, અજ્ઞાનમાં વિલય ન થાય; જ્ઞાન, પ્રકાશ અને વિકાસનો પંથ સદાચે આલોકિત રહે, માટેનો પજ્ઝ છે.

આવો ! સૌ મળીને શ્રીરામનું ધ્યાન કરીએ. શ્રીરામ મંદિર નિધિના યજ્ઞમાં આપણે આપણી યાંત્રિકિયાં આહુતિ આપીએ. શ્રીરામ મંદિર-અયોધ્યાનું નથી. કોઈ રાજકારણી વ્યક્તિ વિશેખોનું નથી. ઉપઠી ૪૦૦ વર્ષ શ્રીરામલલ્લા કારાગારમાં હતા. આપણા સંસ્કારોની હોળી પ્રગટેલી હતી. હવે નવો પ્રકાશ આવ્યો છે. નવી આશા અને ઉમંગ છે, માટે જીગો. ઊકો. શ્રીરામ મંદિર નિધિને અશ્વય બનાવવા કમર કસો. ધન્યબન્નો. ઓં શાંતિ.

- સંપાદક

## અત્યારની પેટીમાં આત્મહત્યા કેમ વધી ગઈ છે?

- શ્રી સ્વામી અધ્યાત્માનંદ

પૂજ્ય સ્વામીજીનાં મકરસંકાંતિનાં પ્રવચનમાંથી સાલાર - જેડભાગ

### કારણ

- ૧. આધ્યાત્મિકતા ..... ૦%
- ૨. સંસ્કાર ..... ૦%
- ૩. હિંમત ..... ૦%
- ૪. સાહસ ..... ૦%
- ૫. સરળ-સાધ વિચાર ..... ૦%
- ૬. પરિશ્રમ ..... ૦%
- ૭. આત્મમંથન ..... ૦%
- ૮. પરંપરાગત રહેણી કરણી ..... ૦%
- ૯. વર્તન-વિવેક ..... ૦%
- ૧૦. શારીરિક રમત ..... ૦%
- ૧૧. પ્રભુ ચિંતન ..... ૦%
- ૧૨. શ્રદ્ધા-વિશ્વાસ ..... ૦%

### માત્ર

- Social Media
- Google
- Youtube
- Tik Tok
- Whats app
- Map
- Facebook
- Twitter

### દ્વ્યક્તમાં કહીએ તો

- વિશ્વાસ Googleમાં છે, પિતામાં નથી.
- રસ્તો ભૂલી જાય તો માણસને ન પૂછે - Mapમાં ભરોસો કરો.
- જે - આમતેમ રખડાવીને પહોંચાડે.
- Facebookમાં ૫૦૦૦ મિન્ટો છે, પજ્ઝ અડધી રાતે દુઃખમાં ભાગ લેવા પાડોશમાં કોઈ મિન્ટ નથી.
- ગુરુને કંઈ પૂછે નહીં - Youtubeમાં સર્વ કરો.
- સાઈકલની ચેન ઉત્તરી જાય કે ફ્યૂઝ ઉડે તો પજ્ઝ નેટ ખોલવું પડે.
- ૧૭ X ૫ કેટલા થાય ... કેલ્ક્યુલેટર જુએ. આ કોઈ વ્યક્તિગત વાત નથી. અત્યારની ૮૫% પેઢીની વાત છે.
- બાળકોની સાથે બેસો, સાથે ભોજન કરો, સાથે પ્રાર્થના કરો. ગૌશાળામાં લઈ જાઓ. પશુ-પક્ષી-પ્રકૃતિને ચાહતાં શીખવો. તમો નહીં હો તો પજ્ઝ તંદુરસ્તીસભર જીવન જીવશે.
- ઓં શાંતિ

## મંત્ર-યોગસાધના

ગુરુદેવ શ્રી સ્વામી શિવાનંદજી

### મંત્રયોગસાધનાનું મનોવિજ્ઞાન

મંત્રયોગ વાસ્તવિક વિજ્ઞાન છે. મનનાત્ ત્રાયતે ઇતિ મન્ત્રઃ જેના મનન દ્વારા જીન-મરણના અક્ષમાંથી મુક્તિ મળે છે તે જ મંત્ર.

દરેક મંત્રના દાતા એક ઋષિ હોય છે. વળી, દરેક મંત્રને વિશેષ શક્તિ આપનાર માત્રા, દેવતા તથા બીજ હોય છે તથા દરેક મંત્રને પોતાની શક્તિ તથા ક્રિલક (ખીલો) હોય છે.

મંત્ર ઈશ્વર છે. મંત્ર તથા તેના અધિજાતાદેવ એક જ છે. મંત્ર ખુદ દેવતા જ છે. મંત્ર શબ્દરૂપી શરીરથી પ્રગટ થતી એક દૈવી શક્તિ છે. શ્રદ્ધા, ભક્તિ તથા શુદ્ધિ સાથે સતત મંત્રનો જપ કરવાથી સાધકની શક્તિ વધે છે. મંત્રનું ચૈતન્ય જાગ્રત થાય છે તથા સાધકને મંત્રસિદ્ધિ પ્રાપ્ત થાય છે. તેને જ્ઞાન, મુક્તિ, શાંતિ, નિત્ય સુખ તથા અમૃતત્વની પ્રાપ્તિ થાય છે.

મંત્રના સતત જપ કરવાથી સાધક મંત્રના અધિજાતાદેવના ગુણ તથા શક્તિ પ્રાપ્ત કરે છે. સૂર્યમંત્રના જપથી સ્વાસ્થ્ય, દીર્ઘયુષ્ય, વીર્ય અને તેજની પ્રાપ્તિ થાય છે. તેનાથી શરીર તથા નેત્ર સંબંધી બધા જ રોગો દૂર થાય છે. દુઃખન તેનું કંઈ જ બગડી શકતા નથી. પ્રાત:કાળમાં આદિત્યહંદ્યનો પાઠ કરવો ખૂબ જ લાભદાયી છે. અગસ્ત્ય ઋષિએ આપેલા આ આદિત્યહંદ્યનો પાઠ કરવાથી રામને રાવણ ઉપર વિજય મળ્યો હતો.

સાધારણ રીતે મંત્રોમાં દેવતાઓની સુત્રિ હોય છે. તેમાં કરુણા તથા સહાયની માગણી હોય છે. કેટલાક મંત્રો દુર્યોગાનોને રોકે છે અથવા તેમને કાબૂમાં લાવે છે. શબ્દોનાં લયપૂર્ણ સ્વાનોથી આકૃતિઓની ઉત્પત્તિ થાય છે. મંત્રોના ઉચ્ચારણાથી તેમના ખાસ દેવતાઓની આકૃતિઓનું નિર્મિત થાય છે.

**સરસ્વતીમંત્ર :** ઊં સરસ્વતીની નમઃ | ના જપથી તમને જ્ઞાન તથા પ્રખર બુદ્ધિ પ્રાપ્ત થશે અને તમે પ્રેરણાભરી કવિતાઓ કરવા લાગશો. ઊં શ્રી મહાલક્ષ્મીની નમઃ | ના જપથી તમને સંપત્તિ પ્રાપ્ત થશે અનો તમારી નિર્ધારણાનું નિવારણ થશે. મહામૃત્યુંજ્યમંત્રથી અક્ષમાત, અસ્થાધ્ય રોગ વગેરેનું નિવારણ થઈ દીર્ઘયુષ્ય તથા અમૃતત્વ પ્રાપ્ત થાય છે. આ મોક્ષ-મંત્ર પણ છે.

**સુધ્રાણુમંત્ર :** ઊં શરવણાભવાય નમઃ | ના જપથી કોઈ પણ કાર્યમાં સફળતા મળશે તથા તમને યશ પ્રાપ્ત થશે. તે પ્રેતાત્માઓના ખરાબ મભાવને દૂર કરે છે. શ્રી હનુમાનનો મંત્ર ઊં હનુમતે નમઃ | થી વિજય તથા બળની પ્રાપ્તિ થાય છે. પંચદશાક્ષર તથા ખોડખાક્ષર (શ્રી વિદ્યા)ના જપથી ધન, શક્તિ, મુક્તિ વગેરેની પ્રાપ્તિ થાય છે. તમારી બધી જ મનોકામનાઓ આનાથી પૂર્ણ થાય છે. આ વિદ્યા તમારે ગુરુ પાસેથી જ શીખવી જોઈએ.

ગાયત્રી અથવા પ્રશાવ (૩૦) અથવા ઊં નમઃ: શિવાય, ઊં નમો નારાયણાય, ઊં નમો ભગવતે વાસુદેવાય-આમાંથી કોઈ પણ મંત્રના સવા લાય જપ ભક્તિ, ભાવ તથા શ્રદ્ધાપૂર્વક કરવાથી મંગલ સિદ્ધિ પ્રાપ્ત થાય છે.

ઊં, સોહડમુ, શિવોહડમુ, અહુ ભગ્નાસિ-આ બધા મોક્ષમંત્ર છે. આ બધાથી તમને આત્મસાક્ષાત્કાર માટે સહાયતા પ્રાપ્ત થશે. ઊં શ્રી રામાયનમઃ | ઊં નમો ભગવતે વાસુદેવાય | આ બે સગુણ મંત્રો છે, જેનાથી પહેલાં સગુણ સાક્ષાત્કાર પ્રાપ્ત થશે અને બાદમાં નિર્ગુણ સાક્ષાત્કાર થશે.

વીઠી તથા સર્પદશના નિવારક મંત્રોનો ગ્રહણ સમયે જપ કરવાથી સિદ્ધિ વહેલી પ્રાપ્ત થાય છે.

પાણીમાં જોખા રહીને મંત્રનો જપ કરો. આ અધિક શક્તિશાળી તથા પ્રભાવશાળી છે, જોકે મંત્રસિદ્ધિ પ્રાપ્ત કરવા માટે આ મંત્રોનો જપ બીજા કોઈ દિવસે પણ કરી શકાય છે.

વીણી તથા સર્પદંશના નિવારક મંત્રની સિદ્ધિ તમે ચાળીસ દિવસમાં પ્રાપ્ત કરી શકો છો. શ્રદ્ધા તથા ભક્તિપૂર્વક મંત્રનો નિયમિત જપ કરો. પ્રાતઃકાળમાં સ્નાન કર્યા પછી જપ કરવા બેસો. બ્રહ્માર્થનું પાલન કરો તથા ચાળીસ દિવસ સુધી દૂધ તથા ફળાહાર લો અથવા મિતાધારી બનો.

મંત્રોથી અસાધ્ય રોગો પણ દૂર કરી શકાય છે. મંત્રના જપથી આધ્યાત્મિક તરંગો અથવા દિવ્ય સ્પંદનો પેદા થાય છે. તે રોગીના સ્થૂળ તેમજ સૂક્ષ્મ શરીરમાં પ્રવેશ કરીને કણના મૂળનું નિવારણ કરે છે. તે જીવકોશોને ‘સત્ત્વ’થી ભરી દે છે. તે અલ્લાવાયોલેટ કિરણો કરતાં પણ વધુ શક્તિશાળી છે.

મંત્રશક્તિનો દુરુપ્યોગ બીજાના વિનાશ કાર્ય માટે કદ્દી નહિ કરવો જોઈએ. જે લોકો મંત્રશક્તિનો દુરુપ્યોગ કરે છે તેઓ પોતે જ અંતે નાશ પામે છે.

જે લોકો સર્પદંશ, વીણીનો ઊંખ તથા અસાધ્ય

બીમારીઓના ઉપયાર માટે મંત્રશક્તિનો ઉપયોગ કરતા હોય તેમણે કોઈ પણ પ્રકારની લેટ અથવા ધન લેવું ન જોઈએ. તેમણે સંપૂર્ણ રીતે નિષ્ઠામ ભાવથી આ કામ કરવું જોઈએ. તેમણે ફળ તથા વાણોનો પણ સ્વીકાર ન કરવો જોઈએ. જો સ્વાર્થ ખાતર સિદ્ધિનો ઉપયોગ કરશો તો સિદ્ધ ચાલી જશે. જો તેઓ સંપૂર્ણ રીતે નિઃસ્વાર્થ રહીને જ સર્વત્મભાવથી માનવતાની સેવા કરતા હશે તો ઈશ્વરકૃપાથી તેમની શક્તિ વધતી જ જશે.

જેમને મંત્રસિદ્ધિ પ્રાપ્ત છે, તે સર્પદંશ અથવા વીણીના દંશને કે અસાધ્ય રોગને પોતાના સ્પર્શમાત્રથી મટાડી શકે છે. જો કોઈ માણસને સાપ કરણો હોય તો જેણે મંત્રસિદ્ધિ પ્રાપ્ત કરી છે તેને તારથી અથવા બીજા રીતે ખબર કરવામાં આવે છે, જેથી તે માણસ જપ કરે છે અને સાપનું જે ઉત્તરી જાય છે. કેટલું આશર્થજનક છે! શું આનાથી મંત્રની અલોકિક શક્તિ સિદ્ધ નથી થતી?

તમારા ગુરુ પાસેથી મંત્રદીક્ષા મેળવો. જો ગુરુ પાસેથી મંત્રદીક્ષા મળવામાં મુશ્કેલી જણાતી હોય તો તમારા ઈષ્ટદેવતાને પ્રાર્થના કરો અને કોઈ ખાસ મંત્રનો જપ શરૂ કરો.

□ ‘સાધના’ માંથી સાભાર

## ઇશ્વર કૃપા

પંચદશીના પ્રણેતા શ્રદ્ધેયશ્રી શ્રી વિદ્યારઘ્ય મુનિ એક સર્વ સાધારણ બ્રાહ્મણ ગૃહસ્થી હતા. દરિદ્રતાએ તેમનાં જીવનની ધરા ધુરાને ભાંગી નાખી હતી. તેઓએ ગાયત્રી મંત્રના જપ માટે સંકલ્પ કર્યો. સાડાગ્રણ કરોડના એક એવાં ત્રણ પુરાચ્ચરણ કર્યો. કંઈ પ્રાપ્ત નહીં થાય, તેવી મનોવેદના સાથે તેમણે તેમની શિખા અને સૂત્ર તોડી નાંખ્યાં. હાથ ઊંચા કરીને ‘સન્યસ્ત’ના મંત્રો બોલવા લાગ્યા. કહેવાય છે, કે ત્યાં ગાયત્રી દેવતા પ્રગત થયા. કહું, ‘વરે બુધી; વરદાન માગો.’ પરંતુ હવે વિદ્યારઘ્ય મુનિને કોઈ ઈશ્વર તૃખણા કે વાસના રહી ન હતી. તેમણે કહું, “કહો! અત્યાર સુધી કયાં હતા?” થોડું પાછળા

હરીને જુઓ. ત્યાં સાત પણ બળી રહ્યા હતા. “તમારાં પૂર્વ જન્મોનાં પાપ બળી રહ્યાં છે. તેમાંથી તમારી મુક્તિ ન થાય ત્યાં સુધી કેમ અવાય? બોલો શું હવે શું આપું?” વિદ્યારઘ્ય મુનિએ કહું આ ભૂમિને કૃતાર્થ કરો, અહીં કોઈ ભૂખ્યું કે દુઃખી ના રહે, “આજે પણ અહીં ધન વર્ષા થાય છે. આ સ્થળ છે તિરુમલા તિરુપતિ બાલાળ. તિરુમલા એટલે પવિત્ર પર્વતો. આ સ્થળને સાત ગિરિ પણ કહેવાય છે. માટે પૂજ્ય બાપુજ્ઞ મહાત્મા ગાંધીજી કહે છે, ‘પ્રલુ સાંભળો છે. વહેલાં કે મોડાં તે આપણી પ્રાર્થનાનો ઉત્તર આપે જશે.’”

## મન સમસ્યા બને તે માટે આપવામાં આવ્યું નથી

- શ્રી સ્વામી ચિદાનંદજી

પ્રકૃતિનાં આ જગતમાં રજોગુણ પ્રબળ છે. તેથી હંમેશા ગતિ રહે છે. રજોગુણ ગતિશક્તિ છે, ગતિવિધિ છે, સંકયતા છે. તમારા સ્વભાવનો તે અંશ છે, પ્રકૃતિનો અંશ છે પણ તમારું નિજ સ્વરૂપ, જે પરિપૂર્ણ છે તેનો ભાગ નથી. પરિપૂર્ણમાં કોઈ ગતિવિધિ નથી, કારણ ગતિવિધિની જરૂર નથી. ત્યાં કંઈ મેળવવાનું નથી, કંઈ પામવાનું નથી, કારણ નિજ સ્વરૂપ નિત્ય પ્રાપ્ત છે, નિત્ય પરિપૂર્ણ સત્તા છે. તેની પૂર્ણતા કરી ઘટે નહિ, કરી બદલાય નહિ. તેનું સાહુ કારણ એ છે કે તે સત્ય છે, સત્તા છે. જેમાં કંઈ પરિવર્તન થાય તે સત્તા નથી. સત્તા અપરિવર્તનીય, અવિકારી છે.

જીવનમાં પ્રવૃત્તિ અને ગતિવિધિ અપરિહાર્ય છે, આવશ્યક છે અને જીવનનો અનિવાર્ય ભાગ છે. સમજું સાધક આ વાત જ્ઞાનો હોઈ ઉડો વિચાર કરે છે અને આ પ્રવૃત્તિને, આ ગતિવિધિને યોગ્ય માર્ગ વાળવા માટે સૌથી વધુ ડહાપણભરી દિશા પસંદ કરે છે, જેથી આ અપરિહાર્ય, અનિવાર્ય ગતિવિધિ પ્રગતિનું રૂપ લે; જે સંધરું સત્ય, શિવ અને સુંદર હોય તેને આગળ વધારવાનું રૂપ લે; જે બધું ધન્ય, પવિત્ર, ઉમદા, ઉત્કૃષ્ટ, દિવ્ય, અંતિમ પૂર્ણતાનું પ્રતિનિધિત્વ કરતું હોય તેની વૃદ્ધિ કરે.

સાધકના ભાવનો બધો ભાર આ બાબત પર હોય છે. તે આરોહણ છે, તે સ્થગિતા નથી, તે અધ્યપત્રન નથી. તેમ ક્યાંય પહોંચી ન શકાય તેરું ગોળ-ગોળ ફરવાનું પણ નથી. તે નિર્ઝળ પ્રવૃત્તિ નથી; તે અનુત્પાદક કાર્ય નથી; તે નકારી અને કવખતની પ્રક્રિયા નથી. સાધકનું જીવન મન, વચન અને કર્મથી સર્જનાત્મક, વિધાયક હોય છે. તે સાચી દિશામાં છે, કારણ તેને હિરાદાપૂર્વક સાચી દિશામાં વધાવેલ છે-સારાં જીવન, અંતિમ મહાન લક્ષ્ય મતિ વાળેલાં છે.

નેસર્જિક વિકાસનો આ સાર છે. જીવનનો સાચા અર્થમાં; પ્રગતિનો સાચો સાર આ છે. કારણ પ્રાપ્તિ માટે, ઉપલબ્ધ માટે જીવન એક મહાન ભેટ છે. જીવનનો સાર પૂર્ણતા તરફ ગતિ છે, કારણ આ પૂર્ણતા દરેક જીવાત્માને

જન્મજીત મળેલ છે. તેનાં ઉદ્ગમમાંથી જ જીવાત્મા દિવ્ય છે. તે સીમિતતા સાથે પૂર્ણતાનું પ્રગટીકરણ છે. આધ્યાત્મિકતા, ધોર, સાધના, અભ્યાસ અને સાચા જીવનનું ટુંકમાં વર્ણન કરીએ તો આમ કહી શકાય : જીવની સીમિતતા દૂર કરીને જે હતી જ તે પૂર્ણતાને પ્રગટ કરવાની પ્રક્રિયા.

તમારા વિષેનું આ સત્ય; સર્વસાધારણ સમજણ કરી જાય છે, પરંતુ આપણો બે ને બે ચાર કરતા નથી. જીવાત્મા બાબત સત્ય વાત તો એ છે કે તે અપરિવર્તનીય અને સંપૂર્ણ પૂર્ણ છે; તે અવિનાશી સ્વર્ગાયિ આનંદ છે, પરંતુ આ પરમાનંદ પ્રકૃતિમાં ગુંચાપેલો છે. જે ઈચ્છનીય આવશ્યક બાબત છે તે પ્રકૃતિથી પર થઈ એક ફરી વખત વ્યક્તિ જે છે તે બની રહે. પણ પ્રકૃતિથી વ્યક્તિને મુક્ત થવાની વાત પણ ખોટો શબ્દપ્રયોગ છે પણ માનવીય ભાષાની આ સીમિતતા છે, કારણ કે બ્રહ્મને બાંધવા માટે તેવું બીજું તત્ત્વ ન હોવાથી જ્યારે બ્રહ્મને બંધન હોઈ ન શકે ત્યારે બંધનનો કોઈ પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી.

બે વસ્તુઓ હોય તો એકથી બીજાને બંધાય, પરંતુ બ્રહ્મ તો નિરપેક્ષ, અદ્વિતીય અને એક છે. તેથી બંધનનો પ્રશ્ન ઊઠી જ ન શકે તે અર્થવિહીન વાત છે. જીવાત્મા બ્રહ્મતત્ત્વથી જ્યારે પણ જુદો નથી, તેથી જીવાત્મા માટે પણ બંધનનો વિચાર અર્થવિહીન છે એટલે પ્રકૃતિ તમને બંધે છે. તેનાથી ધૂટવાનો સવાલ નથી પણ તમારે તમારો નિર્બધ સ્વભાવ પારખવો પડશે. અને તમારી અભાપિત સત્તા (અસ્થિત્વ) સ્વીકારવી પડશે.

પ્રકૃતિની તમારા પર અસર ન થઈ શકે. પ્રકૃતિ ભલેને હોય, પરંતુ નિત્ય-મુક્તા, સદા-પરિપૂર્ણ બ્રહ્મતત્ત્વની અવસ્થા, જે તમારું નિજ સ્વરૂપ છે તેને અસર કરવા પ્રકૃતિ અશક્ત છે, નિઃસહાય છે. હું સદા બંધનમુક્ત, સદા પરિપૂર્ણ, સદા પવિત્ર હું તેવી સભાનતા એ સ્વભાવનો સાર છે. આ સ્વભાવથી વિરુદ્ધ બીજી બધી વૃત્તિઓનું નિકંદન, બીજી બધી પ્રકૃતિમાં રહેલ વૃત્તિઓ જે મન અને બુદ્ધિનાં રૂપે તમારી નજીક

હોય તેને ગતિશીલ અને અપ્રતિરોધ સદા-મવૃત્ત તત્ત્વવિચાર અને વિવેકબુદ્ધિ વડે તેમજ પ્રકૃતિ સાથે તમારી જતનો એકત્વ-ભાવ દૂર કરવાની, હઠાવી દેવાની પ્રક્રિયાને સાધના કે યોગ કે અભ્યાસ કહેવાય.

સાચી સાધનાની અંદરની કાર્યપ્રણાલી આ છે. જીવાત્માને મન સમસ્યા ઊભી કરે તે માટે નથી આપ્યું. બીજાં ઘણાંની સમસ્યાઓનો ઉકેલ આપવા મન આપેલું છે, કારણ ‘ઘણાં’ની ભાવના જ મિથ્યા છે. એક અને એકમાત્ર જ સત્ય છે એટલે ‘ઘણાં’ની આ આન્તિ દૂર કરવા મન આપ્યું છે. કમનસીબે આપણી ચેતનાના પડદા પર આપણા સત્તુચિદાનંદ સ્વભાવને પ્રગટ ન કરીને આપણી નિષ્ઠિયતાને લીધે, આપણી ગફલતના કારણે મનને સમસ્યા બનવા દીધું છે. જેટલો તમારો શાસ અતૂટ સાતત્યથી તમારા પાણીં શરીરમાં પ્રદર્શિત થાય છે તેટલો જ તમારા સ્વભાવના અંદરના માનસિક પડદા પર સત્તુચિદાનંદ ચેતના પ્રદર્શિત થતી રહેતી જોઈએ. તમારી ચેતનાના અંદરના પડદા પર સત્તુચિદાનંદનો પ્રકાશ હંમેશ પડતો રહેવો જોઈએ, તેને હંમેશ અજવાળતો રહેવો જોઈએ, જેથી તે સત્ય સભાનતાની અવસ્થામાં રહે.

તે અસ્થાલિત પ્રકાશ પડતો રહેવો જોઈએ, તે માટે કોઈ પ્રયત્નની જરૂર ન હોવી જોઈએ; કારણ તે સ્વયંભૂ છે. પ્રયત્ન કરવાની જરૂર હોય તો આપણસ, સુસ્તી, અકર્માધ્યતા, માનસિક ઉદાસીનતાના, તમોગુણને દૂર રાખવા માટે છે. આ એક કરવા જેવી બાબત છે. માટે પ્રકૃતિના રજોગુણને ઉત્કૃષ્ટ સત્તાની દિશામાં ગતિશીલ, ઈરાદાપૂર્વકની દિશા આપવી પડશે. બધા પ્રમાદ, આણસ અને ઉદાસીનતાને ચીરી નાખતી સંપૂર્ણ અંતરતમાની ગતિશીલ આગળ વધતી ગતિવિધિ હોવી જરૂરી છે.

આ લક્ષ્યને સિદ્ધ કરવા તૈથાર થામો, કામે લાગો. તે લક્ષ્યને પ્રાપ્ત કરવા “ઉત્તિષ્ઠત જીવત પ્રાપ્ય વરાન્ન નિબોધત - ઊઠો, જાગો, શાનીજન પાસે જઈ જ્ઞાન પામો. આ સદા-આવર્તિત શાશ્વત હાકલ છે. આ હાકલનો પ્રતિભાવ આપો. તે આવાહન પર ધ્યાન દો. આ લલકાર જે કહે છે તે કરો અને કૃતકૃત્ય બનો. આ છે જીવન! આપણે અહી તેટલા ખાતર જ અવતર્યા છીએ!”

□ ‘મુક્તિપથ’માંથી સાભાર.

### ‘વંદે માતરમ्’

જ્યારે ડૉ. અભુલ કલામ સાહેબ રાખ્રૂપતિ હતા, તારે તેઓએ કુન્જુર જઈને આદરણીય ફીલ્ડ માર્શિલ માણેકશોમનો જેઓ મિલિટરી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. તેમની મુલાકાત લીધી. આ મુલાકાત આકસ્મિક હતી. મુલાકાતમાં ૧૫ મિનિટ પછી શ્રી કલામ સાહેબે તેમનાં સ્વાસ્થ્ય સંબંધી જ્ઞાન કરી મેળવી તેમને અનેકશ: શુલેઝા આપી, જતાં પૂર્વ ફરીથી માણેકશોમજીનો હાથ પકડીને પૂછ્યું! તમોને કિંડ તકલીફ તો નથીને! હું આપને માટે કિંડક કરી શકું? તમારે મન કિંડ વેદના કે વ્યાપી તો નથી ને? જો કિંડ હોય તો અમો આપણી કોઈ આવશ્યક સેવા કરી શકીએ. શોમે કહું, ‘આ એક ફરિયાદ છે.’ દુઃખ અને વધા સાથે તેમજો કહું. કલામ સાહેબે કહું, ‘ઓહ! કહો શું છે?’ વળતો જીવાબ આપતાં માણેકશોમજીએ કહું, ‘મારી પીડા છે કે મારા મહાન ભારતના મહામહિમ રાખ્રૂપતિ મારી સામે ઊભા છે અને હું ઊભો થઈને આપને સેલ્યુટ કરી શક્યો નથી.’

કલામ સાહેબે માણેકશોમનો હાથ પકડ્યો. બંનેની આંખોમાં આંસુ હતાં. ફરીથી કલામ સાહેબે પૂછ્યું... અને હવે પછીની વાત અંતરને અજવાળે તેવી છે. અહી માણેક શોમે કહું, ‘તેમની નિવૃત્તિ પછીનું પેન્શન ફીલ્ડ માર્શિલ માણેકશોમને વીસ વર્ષથી નથી મળ્યું’.

મનમાં હોલ લઈને રાખ્રૂપતિ શ્રી કલામ સાહેબે ફિલ્ડ જઈને રેમન્નું બાકી રહેલું પેન્શન અને તેનું એરિયર્સ એક જ સમાહિમાં માણેક શોમને પહોંચાતું કર્યું. તે ચેક હું. ૧.૨૫ કરોડનો હતો. ડિફન્સ સેકેટરીએ સ્વયં જ્યાં માણેક શોમ સાહેબ આમી હોસ્પિટલમાં હતા ત્યાં વિલિંગહન-ગેટી સ્પેશિયલ પ્લેનમાં જઈને આ ચેક તેમને સુપ્રત કર્યો.

આદરણીય એ.પી.જેની આ મહાનતા હતી, પરંતુ આ ચેક મેળવીને ફીલ્ડ માર્શિલ માણેક શોમ સાહેબે સત્તવરે જ તેને આમી રિલિફ ફિલ્માં દાનમાં આપી દીધો.

સલામ કોને કરવી!!! વંદેમાતરમ્

## સાંખ્યનું સ્વરૂપ-૪

શ્રી સ્વામી કૃષ્ણાનંદજી

જ્ઞાન એ કર્મની પૂર્વ ભૂમિકા છે. જે રીતે આપણે વર્તવું પડે છે, જગતમાં આપણું જીવન પસાર કરવું પડે છે, તેનું જ્ઞાન એ એક કાર્ય પદ્ધતિ છે. આમ, તત્ત્વની સમજજ્ઞા અને એનો કર્મમાં વિનિયોગ સાથે-સાથે જ ચાલે છે. જ્ઞાન અને કર્મ છુટાં પારી શકતાં નથી. સામાન્ય બુદ્ધિનો અર્થ જેને 'કર્મ' કહે છે, તે 'યોગ' કહેવાય નહિ પણ કર્મ જીવારે માણસનાં અસ્તિત્વનાં મૂળરૂપમાંથી ઉદગમ પામે ત્યારે જ તે 'યોગ' કહેવાય છે અને આ યોગનો મહાવરો જેમ જેમ વધતો જીશે તેમ તેમ ધીરે ધીરે મનુષ્યનાં અસ્તિત્વનું પરિમાણ વધું ને વધુ વિશાળ અને વ્યાપક બનતું જીશે અને છેવટે એ પૂર્ણતા પામશે. શ્રીકૃષ્ણો કહું : 'આ યોગ-ધર્મનું સ્વલ્ય અનુસરણ પણ મોટા લયમાંથી બચાવે છે.'

"નેહામિક્રમ નાશોરસિત" - "આત્માની પૂર્ણત્વમાં સાથેની આ ભવ્ય અભિમુખતામાં કોઈ પણ પ્રકારની હાનિ થતી નથી." સાચી દિશામાં ભરેલું એક નાનકું પગલું પણ એક મોટું જમા પાસું છે. ભલેને તે પ્રયત્ન ગમે તેટલો નાનો હોય, 'કંઈક સાંદું કર્મ છે' એમ સમજી મનુષ્યે આવી બાબતમાં આનંદ અનુભવવો જોઈએ અને આ 'સાંખ્ય'ની પૂરી સમજજ્ઞાથી જે કંઈ પણ કરવામાં આવ્યું હોય એ બધું સાંદું અને સાંદું જ હોય છે. જ્ઞાનની આ પાર્શ્વ ભૂમિકા વગર કરેલું કર્મ હોય તો તે સાંદું-સાંદું નથી જ હોટું અને તે કર્મ કરનારાનું બંધનનું કારણ-બંધનમાર્ગ-બની રહે છે. આપણો કર્મ કરવાનો અધિકાર છે. કર્મચિરણાનાં કોઈ પણ ફળની અપેક્ષા રાખવાનો આપણને અધિકાર નથી. ભગવદ્ગીતાના ઉપદેશનો આ સૌથી વધુ મહત્વ ધરાવતો પ્રધાનસૂર છે. આ એક એવી વાત છે કે જેને આધુનિક મન સમજ શકતું નથી. કારણ કે એ તો બીજ વાયાં પહેલાં જ ફિલાશાના કોચડમાં ખૂબી ગયું છે. જે સમજમાં આપણે રહીએ છીએ તેના તરફની આપણી દેખીતી ફરજોને ઉવેખીને જગત પાસેથી આપણે બસ હકની માગણીઓની આશાઓ પાછળ ઢોડી રહ્યા

છીએ. તમે તમારાં કર્મનાં ફળની આશા રાખી શકો નહિ, આવી આશાઓ રાખવી એ મોટી ભૂલ છે. કારણ કે ફળો પામવાં એ તમારા હાથની વાત નથી. જ્યારે કર્મ - ધર્મ - ફરજ એ તો તમારા ઉપરનું ઝણ છે. ખેતરમાં બીજ વાવવાનો એક સામાન્ય દાખલો લો. કોઈ ખેડૂતના કામ તરફ નજર માંડો, તે પોતાની ફરજ સારી રીતે અદા કરે છે. પણ એનું ફળ બધું એના જ હાથમાં છે એમ તમે કહી ન શકો. ખેતરમાં જે ફસલ એણો પક્વવાની છે તે ઉત્પાદનના ફળમાં ફાળો આપતી એવી કેટલીય બાબતો છે કે જે ખેડૂતોના હાથમાં નથી. વરસાદ આવવો જોઈએ, હવામાનની પરિસ્થિતિ અનુકૂળ હોવી જોઈએ, અને બીજી એવી ઘણી વસ્તુઓ છે, તે તમે જણ્ણો છો, કર્મનું ફળ - પરિણામ - તો માનવવ્યક્તિ સમજજ્ઞા બહાર હોય એવી કેટલીક બાબતો નક્કી કરે છે, અને તેથી કોઈ કર્મના ખાસ ફળની આશા રાખવી તે માણસ માટે અશાનની પરિસીમાં છે. આપણે કેટલાંક કામ કરીએ છીએ, અને એના ખાસ પ્રકારની ફળની આશા રાખીએ છીએ, તેથી જ આપણે દુઃખી થઈએ છીએ અને આપણે આશા રાખેલાં એ ફળ મળતાં નથી. એનું સીધું સાહુ કારણ એ છે કે ફળની ઉત્પત્તિ માટે બીજી કેટલીક શરતો પૂરી કરવી પડે છે. કહેવાતો કર્મ કરનાર કેવળ નિર્ણય કરી નાખે એટલું જ પૂરતું નથી. હું એક પ્રતિનિધિ-કર્મ નિર્ણય કરનાર - તરીકે ભલે કર્મ ફળની શરતો માણેની એક શરતરૂપ હોઉં. હા, એ સ્વીકાર્ય છે પણ હું એ કંઈ એકમાત્ર શરત નથી. અને મને જ એકમાત્ર કર્મ ફળની ઉત્પત્તિ પાછળની શરતના - સાપેક્ષતાના - સિદ્ધાંત તરીકે ગજવામાં આવે, તો એ અજ્ઞાન છે અને સાંખ્યના જ્ઞાનનો અભાવ છે. આથી આપણને આ ઉપદેશમાં વારંવાર કહેવામાં આવ્યું છે કે ફળની આશા રાખવી તદ્દન અયોગ્ય છે. □ 'જીતાદર્શન' માંથી સાભાર

## અહિંસા, સત્ય અને પ્રભુ પ્રેમનો સંગમ

**મહાત્મા ગાંધીજી**

શ્રી સ્વામી અધ્યાત્માનંદજી

સમગ્ર વિશ્વમાં ઠેર ઠેર પૂજ્ય મહાત્મા ગાંધીનાં પૂતળાંને તેમના જન્મદિવસે હારતોરા થાય છે. ગાંધીજીના જેવું કદાચ પૂર્વે કોઈએ આ યુગમાં નહીં કર્યું હોય અને ભવિષ્યમાં કરશે કે કેમ તે એક પ્રશ્ન છે, નહીં તો પોતાની આત્મકથામાં આટલું સ્પષ્ટ સત્ય કોઈ લાભે? તે પ્રશ્ન હતો, “હુલ્લર્યે ત્યારે મને કામુકતાએ ઘેરો ધાર્થો. મારાં પત્ની ગર્ભવતી હતાં. સ્વાસ્થ્ય અને સદાચાર બંને તથા તેમની ઈચ્છા વિરુદ્ધ મેં મારી વાસનાની ભૂખને સંતોષી. હું જ્યારે પિતાશીના ઓરે આવ્યો ત્યારે તેમનું મૃત્યુ થઈ ગયું હતું. તેમની અંતિમ જ્ઞાને મેં દુઃખ આચર્યું. આ આધાત મારાચી સહન થયો. નહીં ને મારાં પત્નીને પણ મૃત બાળક અવતર્યું ત્યારથી મેં કસ્તૂરને કસ્તૂરબા કહેવાનું નક્કી કર્યું.”

પ્રાર્થના કે જીવનના મંડાજી કુમળી વયમાં જ થતાં હોય છે. મોહનને નાની ઉંમરમાં નિશાળે જતાં બીક લાગતી હતી. રસ્તામાં ભૂત છે, પરંતુ ઘરની કામવાળા બાઈએ બાળક મોહનને સમજાવ્યું, ‘રામ રામ બોલ. ભૂત ભાગી જશો.’ અને આ રામનામના આધારે પૂજ્ય બાપુએ ઈસ્ટ ઈન્નિયા કંપનીનું ભૂત ભગાડ્યું.

પોતાનાં મૃત્યુના થોડા જ દિવસો પૂર્વે બાપુએ કોઈને પત્રમાં લખ્યું હતું (આ પત્ર સાબરમતી આશ્રમમાં છે.) મૃત્યુ પૂર્વે હું બેભાન અવસ્થામાં લાઈફ સપોર્ટિંગ સિસ્ટમ ઉપર હોઉં ને મૃત્યુ પામું તો જીણજો કે હું ઢોળ્યો હતો. મેં મારી જાતને અને દેશને છેતર્યા છે, પરંતુ જો હું પ્રાર્થના કરતો હોઉં કે પ્રાર્થના કરવા આવતો કે જતો હોઉં અને મને કોઈ ગોળી મારે એ સમયે હું રામનામ બોલીને મરું તો સમજજો કે હું સત્યનું જીવન જીવો છું. મેં મારી જાતને છેતરી નથી. મેં ઈશ્વરને સાચા દિલથી ભજ્યા છે

અને જગ વિદિત છે કે બાપુ એક વાર નહીં ‘હે રામ!’ બે વાર બોલ્યા હતા અને વસમી વિદાય લીધી હતી.

પૂજ્ય બાપુજીનું જીવન આભૂષણ તેમની પ્રાર્થના હતી. તેઓ સદૈવ કહેતા, ‘પ્રાર્થના કરો. મનથી પ્રાર્થના કરો. હૃદયના ઉદ્ગારથી પ્રાર્થના કરો. પ્રાર્થના એટલે કંઈ માગવાનું નથી. પ્રાર્થના તો પ્રભુ સાથે જોડતો સેતુ છે. કોઈ પણ પ્રાર્થના કંઈ પણ નિષ્ફળ જતી નથી. વહેલી મોડી તમામ પ્રાર્થનાઓનો પ્રત્યુત્તર પ્રભુ આપે જ છે, આ મારી અનુભૂતિ છે.’ બાપુનું જીવન એક સત્યપ્રતી, નિર્માહી અને રાષ્ટ્રને સમર્પિત હતું. તેનો પાયો હતો - અંગત જીવનનું અનુશાસન, આત્મનિષ્ઠા અને દઢ સંકલ્પશક્તિ.

જ્યાં સુધી સત્યનો પ્રશ્ન છે પૂજ્ય બાપુજીને મન સત્ય એટલે ઈશ્વર અને ઈશ્વર એટલે સત્ય. સત્ય તેમના હૃદયનું સ્પદન હતું. આ સમગ્ર વિશ્વ ‘સત્ત’ ના આધારે જ ટકી રહ્યું છે.

પૂજ્ય બાપુજીએ ‘સત્ય’ વિચાર, વાણી કે વર્તના વિશે લેશમાત્ર બાંધછોડ કરી નથી. અને જીવનની સ્પષ્ટ સમજજી એટલે જ્યાં સત્ય છે, ત્યાં જ સત્ત ચિત્ત આનંદ છે. સત્ત સિવાય બીજું કંઈ પણ જ્ઞાન હોઈ જ શકે નહીં. ચિત્ત અથવા જ્ઞાન એટલે પણ ઈશ્વર જ થાય અને જ્યાં જ્ઞાન (Bliss) હોય ત્યાં અજ્ઞાન, શોક કે હું જ પણ ન જ હોય. સત્યમાં નિષ્ઠા, શ્રદ્ધા અને વિશ્વાસ એ જ માનવ જીવનનાં અસ્તીત્વની આધાર શિલાઓ છે. આપણી બધી જ પ્રકૃતિઓ સત્યને જ કેન્દ્રમાં રાખીને કરવી જોઈએ. ખરેખર, સત્યનો જ જ્ય છે. સત્યથી મોટો કોઈ ધર્મ નથી.

## આહાર મનનું નિર્માણ કરે છે - ૨

- શ્રી સ્વામી સત્યિદાનંદજી

ધોળી તરીકે અમે બીજાને ઓછામાં ઓછી તકલીફ પડે તેમ ઈચ્છાએ. જો અમારી જીબને માંસ ખાવાનું મન થાય તો તેને નિર્યાતિત કરવાનું સહેલું છે. અમે કહીએ : “વનસ્પતિમાં પણ ચૈતન્ય છે.” વનસ્પતિમાં નિઃશંક ચૈતન્ય છે અને વૈજ્ઞાનિકોએ પ્રયોગો દ્વારા તેની સાબિતી પણ આપી છે. જ્યારે આપણે તેનો ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ ત્યારે તેને ઈજી કરતાં હોઈયું પણ આ વાતનો સૂક્ષ્મ રીતે વિચાર કરવો જોઈએ. વનસ્પતિ, ગ્રાણીઓ અને મનુષ્ય વચ્ચેનો તફાવત તેમના ચૈતન્યની વિસ્તૃતતા પર છે. વૃક્ષમાં ચૈતન્ય છે પણ તે ઓછા-વત્તા પ્રમાણમાં સ્વખાવસ્થા સ્થિતિ જેટલું હોય છે. પથ્થરમાં પણ ચૈતન્ય છે. તેનું પ્રમાણ સુધુપાવસ્થાના ચૈતન્ય જેટલું હોય છે. દરેક પદાર્થમાં ચૈતન્ય હોય છે, પરંતુ ચૈતન્યની વિસ્તૃતતા તથા વ્યક્તતાનું પ્રમાણ ભિન્ન ભિન્ન હોય છે. મનુષ્યમાં ચૈતન્ય વધુમાં વધુ વિસ્તૃત તેમજ વ્યક્ત હોય છે. અને તેથી મનુષ્યમાં વધુમાં વધુ લાગણીશીલતા પણ હોય છે. વસ્તુનું ચૈતન્ય જેમ વધુ વિસ્તૃત તેમજ વધુ વ્યક્ત તેમ તે વધુ સંવેદનશીલ. સહેજ પણ સ્પર્શની તરત અસર થાય.

આ સંવેદનશીલતા બધા મનુષ્યમાં એકસરખી હોતી નથી. ચાલીસ વિદ્યાર્થીઓના વર્ગનો વિચાર કરીએ. શિક્ષક વર્ગમાં દાખલ થાય છે ત્યારે બે વિદ્યાર્થીઓ તોફાન કરતા જગ્ઘાય છે. તેમાંનો એક ભજવામાં ખૂબ હોશિયાર છે અને બીજો તદ્દન ઠોક છે. શિક્ષક ગુસ્સે થઈ કહે છે; “અરે મૂખાંઓ તમે શું કરી રહ્યા છો?” તેમના ઠપકાથી તેમની લાગણી ઘવાશે? હા, પણ કોના મન પર વધુ અસર થશે? આપણને કોઈ કિલસૂફ કે માનસશાળીનો જવાબ જોઈતો નથી. સામાન્ય સ્તરથી વિચારીએ તો ભજવામાં ખૂબ હોશિયાર વિદ્યાર્થી પર શિક્ષકના ઠપકાના શબ્દોની વધુ અસર થશે. બીજો કદાચ હતી કાઢશે: “હા-હા તેમજો મને મૂર્ખ કહ્યો. તેમજો મને

મહત્વ તો આયું.” તેની સાથે ભાગ્યે જ બોલતા શિક્ષકના શબ્દોથી મગજુર પણ બન્યો હોય. તે આ રીતે પણ ધ્યાન ખેંચી શક્યો તેનો આનંદ પણ થયો હોય પણ વધુ તેજસ્વી વિદ્યાર્થી તેની સંવેદના ઘવાઈ હોવાથી થોડીક રાત્રિઓ શાંતિથી ઊંઘી નહિ શક્યો હોય.

આ બુદ્ધિના વિકાસ અને ચૈતન્યની વિસ્તૃતતાના તફાવતના લીધે છે. જેમ વધુ વિકસિત તેમ વધુ લાગણીશીલ. જો ખોરાક માટે કોઈને મારી નાખવાનું જ હોય તો તમે મનુષ્યને મારી નાખવાનું વધુ પસંદ કરશો, કારણ કે તમે જીબો છો કે પણ કરતાં મનુષ્ય વધુ સંવેદનશીલ હોય છે. તે જ પ્રમાણે વનસ્પતિની સંવેદનશીલતા પ્રાણીની સંવેદનશીલતા કરતાં ધંડી ઓછી હોય છે. ખોરાક માટે આપણે કોઈકને તો ઈજી પહોંચાડવાની જ હોય તો જેની સંવેદનશીલતા ઓછી હોય તેનો જ ઉપયોગ કરીએ.

આ જ મુદ્દો છે : શક્ય હોય ત્યારે ઓછામાં ઓછી ઈજી થાય તે લક્ષમાં રાખતું. પછી કોઈ વૃક્ષ ઉપરથી ફળ તોડવાનું હોય તો પણ કાંચું સફરજન જલ્દી જોર કર્યા વગર તૂટતું નથી પણ બીજા પાકાંને તમે અડો કે તરત જ તમારા હાથમાં આવી જાય છે. કંચું ફળ લેવાથી વૃક્ષને ઓછી ઈજી થશે? તમે જ્યારે પાંકું ફળ તોડો ત્યારે વૃક્ષને કદાચ આનંદ થશે, કારણ કે તે આપવા માટે તૈયાર છે અને તમે તેનો સ્વીકાર કરો છો. બીજું ફળ કહી શકે : “મને તોડશો નહિ, હું હુંજું કાંચું છું.” પછી જો તેને બણજબારીથી તોડો તો તેને ઈજ થાય. તમે કોઈને ઈજી ન થાય તે માટે સજાગ હો તો આવાં સૂક્ષ્મ ચૈતનાના વિચારનાં ઉદાહરણો નોંધી શકાય.

જો ખોરાક તમને ખૂબ સહેલાઈથી મળી શકે તો તમે ખાઈ લો પણ જો તે તમારાથી દૂર ભાગે તો તેને

અનુસંધાન પાનં નં ૧૭ ઉપર

## સ્વામી વિવેકાનંદ અને યુવાવર્ગ

શ્રી સ્વામી નિષ્ઠિલેશ્વરાનંદજી

આંતરરાષ્ટ્રીય યુવા વર્ષના ઉપક્રમે ૧૯૮૫માં ભારત સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો હતો - સ્વામી વિવેકાનંદના જન્માદિન ૧૨ જાન્યુઆરીને પ્રતિવર્ષ રાષ્ટ્રીય યુવાદિનના રૂપમાં ઊજવવો. ભારત સરકારે આનું કારણ આપતાં કહ્યું છે કે - ‘એનું જોવામાં આવે છે કે સ્વામી વિવેકાનંદનું દર્શન અને જે આદર્શનું એમણે પાલન કર્યું તથા જેમનો એમણે ઉપદેશ આપ્યો એ ભારતના યુવાવર્ગ માટે પ્રેરણાનો મહાઓત બની શકે તેમ છે.’ આના સંદર્ભમાં ભારત સરકારે રાષ્ટ્રીય યુવા સપ્તાહ (૧૨થી ૧૯ જાન્યુઆરી) ઊજવવા જે કાર્યક્રમ યોજવા નિર્દેશ આપ્યા છે તેમાં સ્વામી વિવેકાનંદના આદર્શ પર વિચાર કરવાને મહત્વપૂર્ણ સ્થાન આપ્યું છે. ભારત સરકારનું આ પગલું અત્યંત પ્રશંસનીય છે. ખરેખર તો આ ઘોષણા આજાદી પછી તરત જ થવી જોઈતી હતી. જેર, જાગ્યા ત્યારથી સવાર.

શિર યુવા સ્વામી વિવેકાનંદ યુવાવર્ગ માટે સદાય આદર્શરૂપ છે. સ્વામી વિવેકાનંદે ઉદ્વર્ણની વર્ણના વયમાં જ મહાસમાધિ લીધી અને આમ પોતાની યુવાવસ્થામાં જ મહાનતાનાં શિખર આંખી લીધાં હતાં. ભૌતિક તથા ભાવરૂપે બંને રીતે તેઓ સદા યુવા રહ્યા. ૧૨ ભાગોમાં પ્રગટ થયેલ સ્વામી વિવેકાનંદના સંપૂર્ણ સાહિત્યનું અધ્યયન કરવાથી જોવા મળશે કે તેમણે લખેલા મોટા ભાગના પત્ર પોતાના યુવા ગુરુભાઈઓ અથવા આલાસિંગા પેરુમલ, ભગિની નિવેદિતા વગેરે યુવક-યુવતીઓને લખેલા, મોટા ભાગના તેમના વાર્તાલાપ શરતચંદ્ર ચક્વર્તી વગેરે યુવકો સાથે થયેલા. મોટા ભાગનાં તેમનાં વ્યાખ્યાનના શ્રોતાઓ યુવકો (ભારતમાં) અને યુવતીઓ (વિદેશમાં) હતાં. તેમનાં વ્યાખ્યાન સાંભળી અથવા વાંચીને ઘણાં યુવક-યુવતીઓએ પોતાનું

જીવન ભારતવર્ષ માટે સમર્પિત કરી દીધું હતું. ભગિની નિવેદિતા, શ્રી અરવિંદ, સ્વામી રામતીર્થ, મહાત્મા ગાંધી, સુભાષચંદ્ર બોઝ, જવાહરલાલ નહેરુ, ચક્વર્તી રાજગોપાલાચારી, ડૉ. રાધાકૃષ્ણાન વગેરે તથા યુવક-યુવતીઓના પ્રેરણા-ઓત હતાં, સ્વામી વિવેકાનંદ.

ગાંધીજીએ કહ્યું હતું, ‘હું તેમનાં (સ્વામી વિવેકાનંદનાં) લખાણો સાંગોપાંગ જીજાવટથી વાંચી ગયો છું અને એ પૂરેપૂરાં વાંચી લીધા પછી મારામાં રહેલો સ્વદેશપ્રેમ હજાર ગણો વધી ગયો.’ સુભાષચંદ્ર બોઝે કહ્યું હતું, ‘શ્રીરામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદ તરફનું મારું ઋશ હું શબ્દો દ્વારા કેવી રીતે વ્યક્ત કરી શકું? તેમના પવિત્ર પ્રભાવ તણે જ મારા જીવનની પહેલી જગ્યાની થઈ હતી. સ્વામીજી આજે જો જીવિત હોતો મારા ગુરુ બન્યા હોત’. તેમણે સ્વીકાર્યું છે કે, ‘અમારા સમયમાં વિદ્યાર્થીવર્ગ પર સ્વામીજીનાં ભાગણો અને લેખોનો જેવો પ્રભાવ પડ્યો તેવો બીજી કોઈ વ્યક્તિએ પાડ્યો નહોતો. તેમણે જાણો કે તેઓની આશા અને અરમાનોને સંપૂર્ણપણે વ્યક્ત કર્યો હતાં.’

સ્વામી વિવેકાનંદનો સંદેશ દરેક યુવા પેઢી માટે પ્રેરક છે. આ સંબંધમાં શ્રી જવાહરલાલ નહેરુએ રામકૃષ્ણ મિશન, દિલ્હીમાં ૧૯૪૮માં જે કહ્યું હતું તે આજની યુવા પેઢી માટે પણ એટલું જ લાગુ પડે છે. તેમણે કહ્યું હતું, ‘અત્યારે યુવા પેઢીના કેટલા લોકો સ્વામી વિવેકાનંદના લેખો અને ભાગણો વાંચે છે તે હું જાણતો નથી પણ હું એટલું કહીશ કે મારી પેઢીમાંના ઘણા લોકો સ્વામીજીની પ્રભાવ અસર હેઠળ આવેલા અને આજની પેઢી સ્વામીજીનાં લેખો અને ભાગણો વાંચશે તો તેમને પણ તે ખૂબ લાભદાયી થશે એમ હું માનું છું.’

કાકા કાલેલકર જ્યારે પોતે તરુણ હતા ત્યારે તરુણો પર સ્વામી વિવેકાનંદની કેવી જગ્યારદસ્ત અસર થઈ હતી તેનું વર્ણન કરતાં તેઓ કહે છે, ‘જે સમયે સ્વામી વિવેકાનંદે દુનિયા અને ભારત પર પોતાનો તેજસ્વી પ્રભાવ પાડ્યો તે સમયનો હું એક તરુણ છું. સ્વામી વિવેકાનંદ પહેલાં અમે કેવી રીતે વિચાર કરતા હતા અને ત્યાર પછી કઈ રીતે વિચાર કરતા થયા, આ આખું પરિવર્તનિમંદો પોતે અનુભવ્યું છે.’

કવિવર રવીન્દ્રનાથ ટાગોરે રોમા રોલાને કહું હતું, ‘તમારે ભારતવર્ષને સમજાવું હોય તો વિવેકાનંદનું અધ્યયન કરો. તેમનામાં બધું જ વિધેયાત્મક છે, કશું જ નિષેધાત્મકનથી.’

રોમા રોલાએ સ્વામી વિવેકાનંદનું જીવનચરિત્ર ફેંચ ભાષામાં લખ્યું ત્યારે સ્વામી વિવેકાનંદની મહાસમાધિને લગભગ ૩૦ વર્ષ થઈ ગયાં હતાં, તેમાં તેઓ સ્વામી વિવેકાનંદના ગ્રંથોની તેમના પરની અસરનું વર્ણન કરે છે - ‘તેમના (સ્વામી વિવેકાનંદના) શબ્દોને જ્યારે સ્પર્શી છું, જે ૩૦ વર્ષ પૂર્વના ગ્રંથોનાં પાનામાં ફેલાયેલો છે ત્યારે ભારા દેહમાં વિદ્યુતનો એક આંચકો અનુભવ્યા વગર રહી શકતો નથી.’

સુખુમ્તપણે રહેલી યુવાશક્તિને જગાડવા માટે આજે આવા વિદ્યુતના આંચકાની જરૂર છે અને યુવાવર્ગનિ એ મળશે સ્વામી વિવેકાનંદના ગ્રંથોમાંથી. એશ-

આરામની આશામાં ડૂબેલી, ફક્ત નોકરી મેળવવામાં જ જીવનનું સર્વસ્વ માનનારી આજની યુવા પેઢીને પોતાનાં ચારિત્ય નિર્માણ અને દેશના પુનર્નિર્માણના કાર્યમાં લાગી જવાની પ્રેરણાશક્તિ સ્વામી વિવેકાનંદના લખાણોમાંથી મળશે.

આજનો યુવાવર્ગ ઉચિત માર્ગદર્શનના અભાવમાં પોતાની શક્તિને કેવી રીતે વેડફી રહ્યો છે ! કૂડ ઓઈલને જ્યારે રિફાઇન કરવામાં આવે છે ત્યારે જ તેમાંથી પેટ્રોલ, ડિઝલ વગેરે મૂલ્યવાન પદાર્થો મળે છે તેવી જ રીતે આજની યુવાશક્તિને પણ રિફાઇન (શુદ્ધિકરણ) કરવાની આવશ્યકતા છે. આ રિફાઇનિંગની પ્રક્રિયા માટે અને યુવાવર્ગના ઉચિત માર્ગદર્શન માટે સ્વામી વિવેકાનંદના ગ્રંથો અત્યંત ઉપયોગી નીવડી શકે તેમણે.

આજે આપણો દેશ જ્યારે ભયંકર કટોકટીમાંથી પસાર થઈ રહ્યો છે, ત્યારે યુવાવર્ગની જવાબદારી વધી જાય છે. સ્વામી વિવેકાનંદની યુવાવર્ગ પાસેથી ઘણી અપેક્ષા હતી. તેમણે કહું હતું - ‘મને યુવા પેઢીમાં-આધુનિક પેઢીમાં શક્ષા છે, ભારા કાર્યકરો આ પેઢીમાંથી જ આવવાના છે. સિંહની માઙ્ક તેઓ સમગ્ર પ્રશ્નોનું નિરાકરણ કરશે.’

□ ‘સંકળતાનું રહસ્ય-સર્વાર્ગી વાક્યાત્મક વિકાસ’ માંથી સાલાર



## પુષ્યચ્છૃતિ

શિવાનંદ આશ્રમ, વ્યવસ્થાના સભ્ય આદરણીય શ્રી કમલેશ ખન્નાજીનાં કરુણામયી અને પૂજ્યા માતુશ્રી શ્રીમતી સરલાદેવી હરિચામ ખન્નાનું દેહાવસાન તા. ૨૧-૧-૨૦૨૧, શાર્કભરી નવરાત્રી અષ્ટમીની સવારે થયું છે. તેમનું વય ૮૪ વર્ષનું હતું. મોતીના દાઢા જેવા અક્ષરોમાં તેમણે અંતકાળ સુધી મંત્રલેખન કર્યું. તેમનાં હૃદય ઉપર બંને ગુરુ ભગવંતોનાં પાદુકાળ પૂજ્ય સ્વામી અધ્યાત્માનંદજી મહારાજે પદ્મરાષ્ટ્રાં હતાં. હરિ ઊં અને ઊં નમો નારાયણાય સ્વમુખે ઉચ્ચારીને તેમણે અંતિમ શાસ લીધા. દિવંગતનો આત્માતો પરમતત્વને પામશોજ. શોકગ્રસ્ત પરિજ્ઞનોને ‘મા’ની પુષ્ય સ્મૃતિ હેત્વર્થ પ્રાર્થના.

ઉંશાંતિ - શિવાનંદ આશ્રમ.

## રામાયણ હકીકત છે, વિદ્વાનોનું કથન છે.

શ્રી અમર તેજસ્વી  
સમાચારપત્ર - સંપાદક DC  
હેઠળાબાદ, જૂન ૧૭, ૨૦૨૦

આપણા પૂર્વજી કે જેમની વાતો આપણાં મહાકાવ્યોમાં છે, તે જનજ્ઞતિને ઓળખી શકાય છે.

દિલ્હી વિશ્વવિદ્યાલયનાં મહાકાવ્યો સંબંધી સંશોધન વિભાગે અધિકૃત માહિતી આપતાં કહ્યું છે કે હજારો વર્ષ પૂર્વે જે રામાયણની ઘટના બની તે વાસ્તવિક છે.

વૈજ્ઞાનિકોનું કથન છે કે અમારા સંશોધનમાં જણાયું છે કે રામાયણમાં જે જે જાતિઓ - જનજ્ઞતિઓ, જેવી કે ગોડ, કોલ કે ભીલનાં વર્ણિન છે, તેમાં પ્રમુખત્વે ગોડ સમુદાય આદીલાભાદ (જિલ્લો - તેલંગાણા) ખાતે હજુ પણ આદિવાસી વિસ્તારોમાં જોવા મળે છે.

૬૦,૦૦૦ વર્ષ પૂર્વની આ પ્રજાનાં પગરણ સંશોધકો દાવા-પુરાવા-અધિકાર સાથે રામાયણમાં વર્ણવેલી આ પ્રજાઓની વાસ્તવિકતાની ઉપલબ્ધિની સાક્ષી પૂરે છે, જેનાં લક્ષણો ૧૨,૦૦૦ વર્ષ પૂર્વથી જે રામાયણમાં વર્ણવેલાં છે તે આ પ્રજા છે.

ગોડ, કોલ અને ભીલ સંબંધી એવું માનવામાં આવે છે કે તેઓ પૌરાણિક આદિવાસી છે કે જેઓ જે પ્રદેશોમાં મળી આવ્યા છે તે પ્રદેશોનું વર્ણન રામાયણમાં કરવામાં આવ્યું છે.

આપણાં આ પૌરાણિક પાત્રો અને ઈતિહાસ સંબંધી અનેક વાર અગણિત પ્રક્રિયા પૂછવામાં આવ્યા છે. જ્યારે આ સંબંધી અધિકૃત માહિતીનું ઉદ્ઘાટન રામાયણનાં કથન અને સત્ય ઘટના સંબંધી પૂછપછી વર્તમાન યુગમાં થોડી વધી જગઈ છે.

દિલ્હી વિશ્વવિદ્યાલયના પુરાતત્ત્વ માહિતી વિભાગના પ્રાધ્યાપક આદરણીય શ્રી ડૉ. વડલામુડી રાધવેન્દ્ર રાવ કે જે તેમનાં એક સંશોધનમાં કહે છે કે, “રામાયણમાં વર્ણવિવામાં આવેલી તમામ ઘટનાઓ સત્ય ઘટના છે. અમારું સંશોધન કહે છે કે, વર્તમાન પ્રજામાં

પૌરાણિક પાત્રોનાં આનુવંશિક ગુણો ધરાવતી પ્રજા છે અને ગહન દાઢિકોણ અને સંશોધનમાં આ હકીકત પુરવાર પણ થઈ છે.”

આપણા પૂર્વજીનાં અસ્તિત્વનાં સંશોધન વિષયક સંશોધક શ્રી શાનેશ્વર ચૌથે (વૈદિક સંશોધન વિશ્વાન) ડૉ. સરોજ બાલાનંદ અને ડૉ. રાધવેન્દ્ર રાવ દ્વારા આ સંશોધન કરવામાં આવ્યું છે.

મહાકાવ્ય રામાયણમાં વિશેષ કરીને ભીલ, કોલ અને ગોડ ભારતીય આદિવાસી તથા જનજ્ઞતિઓનું વર્ણન કરવામાં આવ્યું છે. ખાસ કરીને અયોધ્યાકંડ, અરણ્યકંડ અને ડિંકિધાકંડમાં ગોડ પ્રજાતિનાં અનુવંશજી આદીલાભાદ જિલ્લામાં અને ઈતર રાજ્યમાં પણ મળી આવ્યા છે, જેની ગણના લગભગ ૪૦ લાખ જેટલી તો કરી જ શકાય.

સંશોધનનો અભ્યાસ એમ કહે છે કે, “આ જનજ્ઞતિ અને પ્રજાતિ પથ્થર યુગથી અસ્તિત્વમાં છે; જે વંશજી -આનુવંશિક પ્રજાનું રામાયણમાં વર્ણન છે તે તેને પુરવાર કરે છે.

સંશોધકોનું કથન છે કે આ આદિવાસીઓના સમૂહના ખૂબ જ નિકટતાનો સંબંધ ‘દ્રવિદિયન’ પરિવારોમાં મળી આવે છે કે જેને આપણે દર્શિશ ભારતીય પ્રજા તરીકે ઓળખીએ છીએ.

આર્ય-આર્યપ્રજા ભારતમાં બહારનાં રાષ્ટ્રમાંથી આવ્યા છે કે નહીં તે સંબંધી ફરી વાદ-સંવાદ થઈ રહ્યો છે.

સંશોધનકારોનું કથન છે, અને સ્પષ્ટપણે - દઢતાપૂર્વક કહેવાનું છે કે ૧૨,૦૦૦ વર્ષ પૂર્વે આર્યો ભારતના બાધ્ય પરિસર - માંથી આવ્યા તે કથન-સત્ય નથી. તેને નકારવામાં આવેલ છે.

દિલ્હી વિશ્વવિદ્યાલયના મહાકાવ્ય સંબંધી

સંશોધન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલ સંશોધનમાં સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે, “અમારા ખૂબ જ ગહન સંશોધન અને પૃથક્કરણમાં અમે અનુભવ્યું છે કે પરંપરાગત ત્રણ જનજ્ઞતિ કે પ્રજ્ઞતિના આદિવાસીઓના વંશોજો કે જે વિશાળ સમૂહમાં વર્તમાન ભારતમાં જોવામાં આવે છે તે મૂળ તો ભારતીય જ છે, કે જેને આપણે ‘દ્રવિડિયન’ તરીકે ઓળખીએ છીએ. તેઓ ભારતની બહારથી આવેલી પ્રજા નથી.” આવું સંશોધન દ્વારા માનવામાં આવે છે.

ડૉ. વલામુડી રાધવેન્ડ્ર રાવ કે જેઓ આ સંશોધનના એક પ્રમુખ પ્રવક્તા છે. તેમણે કહ્યું, “DNA-આનુવંશિક ગુણોના સંશોધન દ્વારા આ સત્ય સામે આવેલ છે, અને DNA સંશોધન આ પ્રકારના વિષયમાં સંભવ પણ છે. અમને અમારા સંશોધનમાં સફળ પરિણામ મળેલ છે કે આ આદિવાસીઓનાં પગરણ બાબુ પ્રજ્ઞાઓનું પરિણામ નથી, પરંતુ આપણી જ ભૂમિ પર અસ્તિત્વમાં આવેલ પુરાતન પ્રજા છે.”

આવેલ પુરાતન પ્રજા છે.”

પરંતુ વૈજ્ઞાનિકોનું કથન છે કે ભારતમાં આવેલી આર્થ પ્રજા દક્ષિણ આદિકામાંથી, ખૂબધ્ય રાષ્ટ્રમાંથી ભારતમાં પ્રવેશેલ પ્રજા છે કે જેની ભારતના ભૂખંડ ઉત્તરપૂર્વાયિ પ્રદેશોમાં આજે ઉપલબ્ધ છે.

જ્યારે ભારતના ભૂખંડમાંથી જ પાશ્વાત્ય પ્રદેશો (પુરોપ વગેરે) માં ભારતીય પ્રજાએ સ્વકીય અસ્તિત્વ ઊભું કરેલ છે, જેનો અત્યારે બહુચાર્યિત આ વિષય સંબંધી સમાચાર વિષયક અન્ય વૈજ્ઞાનિકો અને સંશોધકોએ મત આપ્યો છે કે આ ભારતીય પ્રજાના અસ્તિત્વને આધાર કરવાનું એટલે “કેસરિયા રંગ”ના પ્રચારનું કાર્ય છે.

**DC - પત્રકાર, હેઠરાબાદ - જૂન ૧૭, ૨૦૨૦**  
(DC = ડેક્ઝન કોન્ફિડેન્શિયલ હેઠરાબાદનું પ્રમુખ સમાચારપત્ર છે, જે હવે આ વર્ષથી ચેનાઈમાં શરૂ થયું છે.)

### (આહાર મનનું નિર્માણ કરે છે - ૨ પાન નં ૧૩ ઉપરથી ચાલુ)

લેતા નહિ. જ્યારે તમે પ્રાણીને મારો અને તે ચીસ પડે તો તેને તમે ન ખાઓ તો સાંદું. તમે એમ માનતા હશો કે પશુઓનું સર્જન મનુષ્યજ્ઞતના ઉપયોગ-સેવા માટે કરવામાં આવ્યું છે, જો કે પશુઓને આવું કંઈ કહેવામાં આવતું નથી અથવા તેમણે કંઈ ધર્મશાસ્ત્ર વાંચ્યાં હોતાં નથી. આ તો આપણે માણસો જ તેઓ આપણી સેવા માટે છે તેમ ઈચ્છાઓ છીએ. તમારા ઉપયોગ માટે પ્રાણીઓનો ઉપયોગ કરવો તેનો અર્થ મને તમારે ખાઈ જવું એવો ન જ હોય. જો તમે સારી રીતે ખવડાવશો તો ગાય દૂધ આપશો. બળદ ખેતીના કામમાં આવશે અને ઘોડો ગાડી ચલાવશે કે તેના પર સવારી થઈ શકશે.

જો તમારે ત્યાં માંસનું ભોજન પસંદ કરતાં મહેમાન કે માતા-પિતા આવે તો તમારે શું કરવું જોઈએ? આપણા દૈનિક જીવનમાં આવું બનતું હોય છે. કેટલીક વાર એવું પણ બને કે દંપતીમાંના એકને શાકાહાર ફાવતો હોય, બીજાને માંસાહાર ગમતો હોય. આવી

પરિસ્થિતિમાં આપણે આપણો નહિ, બીજાનો વિચાર કરવો જોઈએ. જે ખાણું તૈયાર કરતું હોય તેણે પોતાનું ખાણું તૈયાર કરવાની સાથે પોતાના પતિ કે પત્ની તેમજ મહેમાનો માટે સહેજ પણ મોં બગાડ્યા વગર ખાણું તૈયાર કરી પીરસાંબું જોઈએ. આ ખૂબ મોટી સિદ્ધિ અને મહાન સદ્ગુણ ગણાય છતાં તમે તમારી પસંદગી મુજબ જગ્યા શકો છો પણ આ બધી વાતો ખૂબ અંગત છે. તમને જે ગમે તે બીજાને ગમાડવું જોઈએ તેવો આગ્રહ નહિ રાખવો જોઈએ. જો તમારા કોઈ મિત્રને તમારે વધુ સારા આહાર તરફ વાળખો હોય તો સારા ઉપાયો છે; જ્યારે તે માંદો પડે ત્યારે તમારી સારી તબિયત જોઈ તમારી સલાહ પૂછે તો તમે તેને વધુ સ્વાસ્થ્યકારક ખોરાક માટે સલાહ આપી શકો. તમારી સલાહ તે વખતે વધુ સામર્થ્યવાળી અને સ્વીકાર્ય બનશે.

□ ‘આતમની અટારીએથી’માંથી સાલ્ભાર

## નવી દુનિયામાં-૩

- ડૉ. શ્રી શરદચંદ્ર બેહરા

૧૩ એપ્રિલે સ્વામીજીએ સાન ફાન્સિસ્કો છોડ્યું અને પોર્ટલેન્ડની ટૂકી મુલાકાત લઈ મોન્ટ્રીઅલ આવી પહોંચ્યા. મોન્ટ્રીઅલમાં, ૨૦૨૮, સેન્ટે સ્ટ્રીટમાં આવેલા શિવાનંદ યોગ વેદાંત કેન્દ્રની પ્રવૃત્તિઓને તેમજે માર્ગદર્શન આપ્યું. આ કેન્દ્રના અધ્યક્ષ સ્વામી વિષ્ણુ દેવાનંદ ત્યારે ત્યાં હાજર નહોતા. અહીં એમજે યોગનાં તથા ભારતીય સંસ્કૃતિનાં વિવિધ પાસાં અંગે વ્યાખ્યાનશૈલી ચલાવી. ૧૮મી મેએ તેઓ મોન્ટ્રીઅલથી વાનહુંવર ગયા, જ્યાં સ્વામી રાધા (શ્રીમતી હેલ્બેન) તથા અન્ય ભક્તોએ એમનું ઉમળકાલેર સ્વાગત કર્યું. સાઉથ બુનાભીના હપટ્ટી, માર્લિબરો એવન્યુમાં આવેલા આ શિવાનંદાશ્રમમાં ધ્યાન ઉપર એમજે નિર્યમિત વર્ગો ચલાવ્યા અને યોગની વિવિધ શાખા ઉપર વ્યાખ્યાનમાળા ચલાવી. પતંજલિનું યોગસૂત્ર, ભગવદ્ગીતા અને ઉપનિષદ્દાને પોતાના જીતઅનુભવને આધારે સમજાવ્યાં. ઓગસ્ટના મધ્ય સુધી એમજે કેનેડાના આ પદ્ધિમી વિભાગમાં ગુરુદેવના મિશનને પાર પાર્સું અને પછી ગુરુ દેવના આદેશથી ત્રીજા તથા ચોથા અઠવાડિયામાં એક અંગત કામ માટે પદ્ધિમ જર્મની પણ જઈ આવ્યા.

ઓગસ્ટ આખરમાં તો તેમજે પદ્ધિમ જર્મની છોડી દીધું અને પાછા લોસ એન્જલ્સ આવી પહોંચ્યા. હોલિવુડમાં ઈસ્ટ-વેસ્ટ કલ્યરલ સેન્ટરના ઉપકામે તેમજે ‘યોગના સિદ્ધાંતો’ તથા ‘જીવનનાં આધ્યાત્મિક મૂલ્યો’ ઉપર દ્રશ્ય વ્યાખ્યાનો આપ્યાં. ત્યાંથી ફરી પાછા તેઓ થોડા આરામ માટે વાનહુંવર ગયા. આ દરમિયાન તો આ વિશાળ દેશના ખૂઝે ખૂઝે સ્વામીજીના કાર્તિક ફેલાઈ ગઈ હતી. એશિયન સ્ટીલની અગેરિકન એકેડેમી તરફથી સાન ફાન્સિસ્કોમાં અતિથિ પ્રાધ્યાપક તરીકે વ્યાખ્યાનમાળા ચલાવવા માટેનું નિમંત્રણ તેમને મળ્યું એટલે સાન ફાન્સિસ્કો જવા માટે વાનહુંવર છોડ્યું અને અગેરિકન એકેડેમી ઓફ એશિયન સ્ટીલના વિદ્યાર્થીઓ

સમક્ષ ચાર મહિના સુધી વેદાંત તથા ભારતીય વારસા ઉપર પ્રવથન આપ્યાં. આ દરમિયાન અનેક વર્ગો તેમજ જાહેર વ્યાખ્યાનના કાર્યક્રમ પણ થયા. ઘણી વખત શનિ-રવિમાં પૌલા માતાજી પાસે પણ જઈ આવતા, ત્યારે તે કેન્દ્રનું વાતાવરણ આશ્રમમાં પલટાઈ જતું અને સર્વત્ર આધ્યાત્મિક હવા જાણે ફેલાઈ જતી. અહીં સ્વામીજી તેમનો પૂરો સમય વાતાવરણ, સત્સંગ, સામૂહિક ધ્યાન, યોગાસનના વર્ગો તથા સાધકોનાં ચિત્તના સંદેહ ટાળવા માટેની મુલાકાતોમાં વિતાવતા. ત્યાંના એક નગરગૃહમાં બે વખત એમજે જાહેર વ્યાખ્યાન પણ આપ્યાં. ખાસ કોઈ પ્રચાર પણ નહોતો થયો, તેમ છતાંય આપું સભાગૃહ લોકોની ભીડથી હકેઠઠ થઈ ગયું. ઊભરતા સાધકોની ભીડ માટે એક આત્મસાક્ષાત્કારી દિવ્યાત્માના સત્સંગ દ્વારા અનુભવાતાં આધ્યાત્મિક સ્પંદનો એ એક નવતર અનુભવ હતો. સ્વામીજી સૌને પોતાની કૃપા તથા જ્ઞાનનો પ્રસાદ વહેંચી પ્રેમની લાલાશ કરતા.

આ બધા સત્સંગ યોજનારી કોઈક અગોચર શક્તિનો ઉલ્લેખ કરતાં સ્વામીજીએ પૌલા માતાજીને લખ્યું કે, ‘જો ઈશ્વરેચ્છાનું પ્રબળ જોર અને તમારા અખંડ સ્મરણનું જમાપાસું ના હોત તો મારા પદ્ધિમ જગતના નિવાસ દરમિયાન વારંવાર જેભ્સ ટાઉન આવવા મને કયાંથી ફરજ પડી હોત?’ પૌલા માતાજીની સ્વામીજી પ્રયેની ભક્તિ એ સાચે જ એક અદ્વિતીય અને રોમાંચક ઘટના છે. સ્વામીજીનો એમના પર એટલો બધો ગ્રલાવ હતો કે સ્વામીજીએ જ્યારે અગેરિકા છોડ્યું ત્યારે માતાજીએ પોતાની તમામ માલ-મિલકત વેચી દીધી, પોતાની સંઘર્ષી ભૌતિક સુખ-સગવડ તજી દીધી અને શિવાનંદ આશ્રમમાં કાયમ માટે આવી જઈ પ્રમુખની કુટિર પાસે ઊં કુટિર બંધાવીને પોતાનું જીવન પરમાત્માના ધ્યાન, પ્રાર્થના

તथा ગ્રાહીઓની સેવામાં વિતાવવા લાગ્યા. જ્યારે એમનો અંતિમ સમય આવ્યો ત્યારે તેમની અંતિમ ઈચ્છા એટલી જ હતી કે સ્વામીજીના જ સ્વહસ્તે એમની કાયાને ગંગા નદીમાં વહેવડાવવામાં આવે. સ્વામીજીએ એમની અંતિમ ઈચ્છા અવશ્ય પૂરી કરી. આમ, શું પૂર્વમાં કે શું પાંચિમમાં, સ્વામીજી સ્થૂળ કાર્યક્રમ કરતાં પોતાના ભક્તો તથા સાધકો સાથેના પોતાના અનુસંધાનને જીથાવી રાખવાને વધારે મહત્વ આપતા. સાન ફાન્સિસ્કોથી સ્વામીજી લોસ એન્જલ્સ ગયા. પછી ત્યાંથી ૧૯૬૧ના આરંભમાં હુસ્ટન (ટેક્સાસ), મિલવોક્ઝ (વિસ્કોન્સિન) અને બીજાં કેટલાંક શહેરોમાં ફરીને ગુરુદેવના સંદેશનો પ્રચાર અને પ્રસાર કર્યો. ત્યાર બાદ તેઓ મોન્ટ્રીઅલના શિવાનંદ-યોગ-વેદાંત-કેન્દ્રમાં થોડા દિવસ ગાળવા ગયા. લગભગ દોઢેક વર્ષ સુધી સ્વામીજીએ ઉત્તર અમેરિકામાં યોગ અને વેદાંતનો પ્રચાર કર્યો. ૧૯૬૧ના ભાર્યામાં મોન્ટ્રીઅલ છોડીને તેઓ ન્યૂયોર્ક તથા લંડનમાં એક-એક અઠવાડિયું રહ્યા. સિવિલ્ઝેન્સમાં એક મહિના સુધી વાર્તાવાપ આપ્યા અને સેન્ટ ગોલની નજીક ટ્રોજનમાં ‘ઈસ્ટર સિપરિયુઅલ રીટ્રિટ’ શિબિર ચલાવ્યો.

ત્યાર પછી જૂરિય, બાગલ અને બન્નિમાં જાહેર પ્રવચન આપ્યાં. સિવિલ્ઝેન્સથી તેઓ જિસ્તી સંત પાદ્રેપોના દર્શનાર્થે ઈટાલી ગયા. આ જિસ્તી પાદરી ફાંસના સાધુ હતા અને એમના બેઉ હાથે, બેઉ પગે તથા શરીરની એક બાજુ પર પાંચ ઘાનાં નિશાન હતાં. પોતાની આ પીડાને ઈશ્વરીની યાતના સાથે સરખાવી આ પાંચ ઘાની નિશાની પોતે મેળવી છે તેવું કહ્યું. જ્યારે સ્વામીજી એમને ભણ્યા ત્યારે તેઓ સિતેર વર્ષના ખાસ્સ વધોવૃદ્ધ પાદરી હતા. આવા વધોવૃદ્ધ સંતે યુવાન ભારતીય સ્વામી પર કૃપાપૂર્ણ આશીર્વાદ વરસાવ્યા. સ્વામીજીએ આ આશીર્વાદ મેળવીને પોતાની ઊરી કૃતજ્ઞતા દાખવી. આ પ્રમાણે ઈશ્વરમાં જેમણે પોતાના ચિત્ત તથા સમગ્ર હસ્તી તહ્વાન કરી મૂક્યાં છે તેવા ઈશ્વરભક્તો એકમેકને સમૃદ્ધ કરે છે તથા અજવાણે છે. સ્વામીજી ઈટાલીથી લંડન તરફ આગળ વધ્યા અને ત્યાંથી ફરી ન્યૂયોર્ક જઈ થોડા દિવસ ત્યાં ગાળી દક્ષિણ અમેરિકા માટે રવાના થયા.

□ ‘કરુણા સાગર ચિદાનંદ’માંથી સાલાર

### “નિવ્યાજ પ્રેમ”

હવે શિવાનંદ આશ્રમમાં નિયમિત યોગ વર્ગો પ્રારંભ કરવા તમામ યોગ શિક્ષકોની એક સભા રવિવારે સાંજે બોલાવવામાં આવી. તે સમયે ખૂબ કાળો, વિખરાયેલા વિચિત્ર સ્થિતિના વાળ અને અનેક સ્થળોએથી ફાટેલાં વચો પહેરેલો એક યુવક આવ્યો. સ્વામી અધ્યાત્માનંદજીએ તેને પ્રેમથી આવકાર્યો અને બેસવા માટે કહ્યું. સભા વિસર્જન પછી સ્વામીજીએ પૂછ્યું, “કેમ આવવાનું થયું?” યુવકે કહ્યું, “વિછિયાથી આવું છું.” આ વિછિયા આશ્રમથી ૩૦ કિ.મી. દૂર થાય. ત્યાં આશ્રમ દ્વારા નારાયણ સેવા કરવામાં આવે છે. “વિછિયાથી?” “હા બાપુ” “બોલ આટલી ઠંડીમાં કેમ આવ્યો?” “બાપુ તમારા આશીર્વાદથી મને નોકરી મળી ગઈ છે, તેથી હું તમારી સેવા માટે.....” એક પોટલી

તેણે મૂકી. તેમાં ત્રણ વાર આછા ગુલાબી રેગનું શર્ટનું કાપડ અને બે ગમછા હતા. સ્વામીજીએ ખૂબ પ્રેમથી તે વચો લીધાં. પછી પૂછ્યું, “તને ઠંડી નથી લાગતી?” “ઈતો ઈનું કામ કરે”

સ્વામીજીએ એક યોગાચાર્યને પોતાની કુટિરની ચાવી આપી કહ્યું, “અંદરના ડુમમાં આખી બાંધનું ‘પુલોવર’ છે, લાવો.” તે લાવવામાં આવ્યું. પેલા યુવકે પહેલું પણ ખરું. તે તાઈવાનના ભક્તોની લેટ હતી પરંતુ સ્વામીજીએ કહ્યું, ‘આનાથી ઠંડી નહીં ઉડે ત્યાં બીજું પણ છે. ખૂબ કિંમતી અમેરિકન પુલોવર સ્વામીજીએ તેને પહેરાવ્યું. બંને આંખોમાં રાણ્ણો હતો સંતોષ હતો એક મેકના નિવ્યાજ પ્રેમનો.

- શ્રીમતી રૂપા મજૂમદાર

## આધુનિક યુગનું માદ્યમ - ૩

- શ્રી સ્વામી ચિદાનંદજી

આજના ભારતની યુવાન આવતી કાલના રાખ્રનો આધાર સંલ છે. આજની યુદ્ધથી પીડિત પેઢીના ઉપરાંત તેમણે દેશની લગામ સંભાળવાની છે. માટે બ્રહ્મચર્યની શક્તિ જ તેમને ભવિષ્યનાં કાદ્રાદાયક કાર્યને સફળતાપૂર્વક સંપન્ન કરવા માટેની યોગ્યતા પ્રદાન કરશે. ભારતના યુવાવર્ગને શક્તિશાળી, ઉત્સાહી, શુદ્ધ હંદ્યો તથા આત્મવિશ્વાસુ બનાવવામાં સ્વામીજીનું આ ખૂબ જ મહત્વપૂર્ણ યોગદાન છે; આશા છે કે બધાં જ માતાપિતા, બધા જ શિક્ષકગણ, બધા જ ઉપદેશકો તથા સમસ્ત વિદ્યાલયો, મહાવિદ્યાલયો, પુસ્તકાલયો તથા વાચનાલયો આ પુસ્તકને લઈ, રાખી, વાંચી અને વંચાવીને ગૌરવનો અનુભવ કરશે.

એક વાર જ્યારે હું નવયુવકોની આવશ્યકતાઓ વિશે વિચારી રહ્યો હતો, ત્યારે એક વિચાર મારાં મહત્વમાં ચમક્ક્યો. ક્યારેક એવું પણ બનતું હોય છે કે જ્યારે માણસ રોટલો માગતો હોય પણ તેને પથરા મળતા હોય!

ઉપહાર આપવાના અવસરો પર; જેમ કે જન્માદિવસ, નવું વર્ષ, વિવાહ કે યશોપવીત સંકાર સમયે આપણે ઉપહાર માટે શ્રેષ્ઠ પુસ્તકો આપવાનું જ નક્કી કરવું જોઈએ. રેશમી શર્ટ, ગરમ કોટ, કાંડા ઘડિયાળ, ફાઉન્ટનપેન તથા અન્ય અર્થાતીન ઉપહારોથી પુસ્તકોનો ઉપહાર હજાર ગજો વધુ સારો છે. રેશ વસ્તુઓ તો ક્યારેય પણ ખરીદી શકાય છે. આવી વસ્તુઓ તો માનવને હંમેશા મોહ તો પમાડે જ છે, સાથે સાથે છણ પણ કરે છે. ભલું થાઓ આજની યંત્રયુગની સભ્યતાનું અને લોભાવે તેવી જીહેરાતોની કણાચાતુરીનું!

'જીવનમાં સફળતાનું રહસ્ય' (Sure Ways for Success in Life), 'બ્રહ્મચર્યસાધના' (Practice of Brahmacharya), 'યોગાસન' (Yoga Asanas)

તથા 'યોગસાધના'નો બીજો ભાગ જેવાં, પુસ્તકોનો અમૂલ્ય ઉપહાર આજીવન ઉપયોગી સિદ્ધ થતો હોય છે; કાર્યક્રમ જેને પણ આ ઉપહાર મળશે, તે અવશ્ય જીવન પર્યાન્ત આભારી રહેશે. વિદ્યાલયોમાં પણ વાર્ષિકોત્સવના અવસરો પ્રસંગે જો પુસ્તકોને જ પુરસ્કારારૂપે વિતરણ કરવામાં આવે, તો પુરસ્કારનું મૂલ્ય પણ સો ગણું વર્ષી જાય છે.

અને હવે અંતે 'Inspiring Messages' અર્થાત્ 'પ્રેરણાસ્પદ સંદેશ'નું આલેખન કરીને સ્વામીજીએ સમાજના દૈક વર્ગના બી પુરુષો માટે લાલદાયક સંકેત, સુગ્રાવ, નિર્દેશ તથા ઉપદેશો પ્રદાન કર્યા છે. આ પુસ્તકમાં ડોક્ટર, વકીલ, શિક્ષક, માતા-પિતા, વિવાહિત, અવિવાહિત, વાનપ્રસ્થી, સંન્યાસી, સેવા નિવૃત્ત વ્યક્તિ, નારી વર્ગ, સાધક ગણ, નાસ્તિક અને રોગી લોકો વગેરે સૌને માટે શિક્ષાપ્રદ સંદેશ આપેલા છે.

સ્વામીજીની રચનાઓની વિવિધતા અને વિશેષતા પણ ઉલ્લેખનીય છે. શિવાનંદ સાહિત્યનું અધ્યયન કરનાર પ્રત્યેક વ્યક્તિને પોતાની રુચિ અને હિતનો એકાદ ફકરો તો અવશ્ય મળી જ જાય છે. સાચા સાધકો તથા આધ્યાત્મિક પથના પથ્થકો માટે તો તેમાં આધ્યાત્મિક અનુભવ અને જ્ઞાનનો તો મૂલ્યવાન ઓત જ ભરેલો પડ્યો છે. આત્યાંતિક સત્યને દાખાંતો તથા કથાઓ દ્વારા સમજવાની ઈચ્છા ધરાવતા સાધક માટે પણ પરમ ઉપયોગી તેવાં બે પુસ્તકો છે. 'દાર્શનિક કથાઓ' અને 'યોગવાસિજીની વાતાઓ'. આ બંને રચનાઓમાં ધર્મ અને તત્ત્વદર્શનને ખૂબ જ સરળ, સ્પષ્ટ તથા રોચક શૈલીમાં પ્રસ્તુત કરવામાં આવેલ છે. ગંભીર વિષયોમાં રુચિ ન રાખનારા લોકો માટે આ બંને પુસ્તક

અનુસંધાન પાનનંદ ૨૪ ઉપર

## અચિંત્ય ગુરુદેવ શ્રી સ્વામી શિવાનંદજી-૨

- શ્રી સ્વામી કૃષ્ણાનંદજી

(પૂજ્યપાદ શ્રીમતુ સ્વામી કૃષ્ણાનંદજી મહારાજની ૧૬મી પુષ્પતિથિ નિમિત્તે વિશેષ પ્રસ્તુતિ)

આજે પણ મને થોડી ઘટનાઓ યાદ છે, જેણે મને આંચકો આખ્યો હતો અને છતાં હું તે ઘટનાઓને ગુરુદેવ શ્રી સ્વામી શિવાનંદજીની મહાનતાની નિશાની તરીકે પ્રેમથી યાદ કરું છું. તે કપરા હિવસી હતા, આશ્રમની આર્થિક સ્થિતિ બહુ સારી ન હતી. આશ્રમમાં કોઈએ ફળ ચાખ્યા પણ નહોતાં. તો ખાવાની વાત કર્યાં કરવી ! શ્રી ગુરુદેવ માટે થોડાં ફળ ખરીદવામાં આવતાં હતાં. ફક્ત તેમના માટે જ. તે વધોવૃદ્ધ હતા અને દરેક આશ્રમવાસી કાળજીપૂર્વક તેમનું ધ્યાન રાખતા. દરરોજ થોડાં ફળ ખરીદવામાં આવતાં અને ગંગાના કાંઠ આવેલી ગુરુદેવની કુટીસનાં નાના રસોડામાં રાખવામાં આવતાં. એક હિવસ કેટલાક મુલાકાતીઓ આવ્યા અને ગુરુદેવને પ્રણામ કર્યા. સ્વામીજી તેમને આશીર્વાદ સ્વરૂપે પ્રસારીમાં એક બે ફળ આપવા માગતો હતા.

પૂજ્ય ગુરુદેવે રસોઈયાને પૂછ્યું, “તમારી પાસે કેટલાં ફળ છે?”

“ના, સ્વામીજી, અહીં એક પણ ફળ નથી” રસોઈયાને જવાબ આપ્યો. બિચારો ફળ આપે પણ ક્યાંથી? કરણ કે થોડાં જ ફળ હતાં, જે સ્વામીજી માટે જ ખરીદવામાં આવ્યાં હતાં. સાવ થોડાં ફળ - કદાચ બે કે ત્રણ સફરજન અને અમુક સંતરાં હતાં.

પૂજ્ય ગુરુદેવે કહ્યું, “જીવ અને જુઓ. કેટલાક ફળ હશે.”

“ના, એકેય ફળ નથી” રસોઈયાને કહ્યું.

મુલાકાતીઓ પ્રણામ કરીને પરત ફર્યા. પછી શ્રી ગુરુદેવ રસોઈયાને ફરી પૂછ્યું, “કોઈ ફળ નથી?”

“ના સ્વામીજી, એક પણ ફળ નથી” રસોઈયાને જવાબ આપ્યો.

પૂજ્ય ગુરુદેવ સીધા રસોડામાં ગયા. તે વખતે ત્યાં કઈ મોટું રસોહું નહોતું. કુટીરના એક ખૂણામાં જ સાવ

નાનું રસોહું હતું અને ત્યાં તેમને ફળની એક નાની ટોપલી મળી આવી, જેઅં થોડાં સફરજન અને સંતરાં હતાં. ગુરુદેવ બોલ્યા, “અહીં તો ફળ છે. તેમ કેમ કહ્યું કે કોઈ ફળ નથી. હું મુલાકાતીઓને કેટલાક ફળ આપવા માગતો હતો.”

“ના સ્વામીજી. આ ફક્ત તમારા માટે જ છે” રસોઈયાને જવાબ આપ્યો.

“ઓહ ! મારા માટે?” આમ કહી તરત જ પૂજ્ય ગુરુદેવે ટોપલી લીધી અને વાંદરા તરફ બધાં ફળ ફેંકી દીધાં. તેમે ગુરુદેવના આ વર્તન માટે શું કહેશો? ફળની આખી ટોપલી ફેંકી દીધી. આ દશ્ય જોઈ તેમે શું કરશો? રહશો, આકંદ કરશો કે આ વર્તશુંક સમજવાની કોશિશ કરશો?

મને હંમેશાં એવું લાગે છે કે કોઈ પણ ગ્રંથ કે મહાન ઉપનિષદ પણ, સંતોના જીવનચરિત્ર સામે નાના પડે છે. કદાચ સંતોના જીવનચરિત્રનો અભ્યાસ, શાસ્ત્રના અભ્યાસ કરતાં વધારે શ્રેયસ્કર હોઈ શકે. શ્રી મહીપતિ દ્વારા રચિત ‘મહાભક્ત વિજ્ય’માં આપણને સંતોના પ્રેરણાત્મક જીવન પ્રસંગોનું વર્ણન મળશે. ભક્તિમાર્ગના પથપ્રદર્શક એવા ‘ભોગ્યિયા’ની રોમાંચકારી, હદ્યસપર્શી અને ભક્તિભાવનો ઉમળણી વધારતી ઘટનાઓનું વર્ણન મળશે. આ કથામૂત્ત ગ્રંથમાં ‘વારકરી’ સંપ્રદાયના ઘણા મરાઈ અને કન્નડ સંતોના જીવનચરિત્રની મહાન કથાઓ છે. આ સંત-કવિઓ ‘દુન્યાવી’ દસ્તિએ સાધારણ હશે, પણ તેઓ ‘અલોકિક’ દસ્તિએ મહાન ભક્તો હતા. એકનાથ, નામદેવ, પુરંદરદાસ અને તુકારામ જેવા સંતો સમૃદ્ધ જમીનદાર અથવા કરોડપતિ પરિવારનાં બાળકો ન હતાં. ‘ગરીબી’ એ તેમની એકમાત્ર સંપત્તિ હતી. તેમની પાસે ‘ગરીબી’- ‘સંપૂર્ણ ગરીબી’ સ્થિવાય કર્યું જ નહોતું પણ

‘ઈશ્વરભક્તિ’ આ સંતોની પરમ સંપત્તિ હતી. તેઓ આધ્યાત્મિકતાના ભાવથી સંપત્તિ હતા. પ્રભુ માટેનો તેમનો ગ્રેમ જ તેમની પૂજી હતી. ભક્ત અને ભગવાન બંને અનહદ ગ્રેમની સગાઈએ બંધાયેલા હતા. આપણે લોકો ભગવાન પાસે યાચના કરીએ છીએ. પણ ઈશ્વર

ખુદ આવા સંતોની સેવા કરવાનું પસંદ કરે છે, તથા ઘન્યતા અનુભવે છે. ભગવાન શ્રીકૃષ્ણ સ્વયં, ‘કાંડિયા કિઝા’ના દુપભાં સંત શિરોમણી નામદેવજીના ધરે સેવાકાર્ય બજાવતા હતા. નાના બાળકના સ્વરૂપે ભગવાન પોતે પોતાના આ મહાન ભક્તનાં મેલાં કપડાં ધોતા, તેનાં એઠાં વાસણ માંજતા અને તેના ઘરનાં કચરા-પોતાં પણ કરતા. કથા પ્રસંગમાં એવું વણન આવે છે કે વિશ્વલનાથ-વિઠોબાનાં દર્શનાર્થ, જ્યારે બીજા કોઈ સંત પંદ્રપુર ગયા તો એમને કહેવામાં આવ્યું કે ભગવાન સ્વયં તો નામદેવના ધરે સેવા બજાવે છે. પ્રભુની આવી લીલા સાંભળી આ સંત તો આશ્રમચિકિત થઈ ગયા અને કુતૂહલતા વશ તેઓ તરત જ હાંકળા-ફાંકળા નામદેવજીના ધરે દોડી ગયા. તેમને એવી ઉત્કઠ હતી કે પંદ્રાનાથ વિઠોબા કોઈ ‘ગરીબ’ના ધરે કેવી રીતે હોય? પણ તરત જ બાળસ્વરૂપે આવેલા ભગવાને પોતાની લીલા સંકેલી લીધી અને ત્યાંથી અંતર્ધાન થઈ ગયા. કોઈને ખબર ન પડી કે તેઓ કયાં ગયા. તેઓ કોઈને ન જરૂર.

મહાન ગુરુજીનોના અંતરંગ શિષ્યોએ શી કઠણાઈઓ ભોગવી છે તે સમજવું અઘરું છે. તમે નહિ સમજ શકો કે જે દેખીતી રીતે દુઃખદાયક મુશ્કેલીઓ આવા મહાન ગુરુજીનોના શિષ્યોએ વેઢી છે તે તેમના સ્વભાવના ઘડતરમાં શી ભૂમિકા બજાવે છે? અમારામાંના અમુક સાધુઓ નસીબદાર છે. જે શ્રી સ્વામી શિવાનંદજીના સંપર્કમાં આવ્યા. આવા કદની વ્યક્તિના સંપર્કમાં આવવું ખૂબ જ દુર્લભ છે. તેઓ ઈસુ પ્રિસ્ટ જેવા ઉદાર અને કરુણાસાગર તથા તેમનું દદ્ય અતિશય વિશાળ હતું. તેઓ પોતાના સર્વસ્વનું દાન કરી શકતા. આવી ઉદારતાનાં દર્શન આવા ગુરુજીનોમાં જ થાય. કોઈક વાર ગુરુદેવ સ્વામી શિવાનંદજીને પોતાના

શિષ્યોને આધ્યાત્મિક સિદ્ધાંતોનો ઉપદેશ આપવાનો વિચાર આવતો અને તેઓ આની તત્કષણ ધોખણા કરતા. આવી ધોખણાઓ અચાનક થતી. પહેલાંથી પ્રવચન કે ઉપદેશની કોઈ જીતની જાણ કરવામાં ન આવતી.

આશ્રમમાં, કોલકાતાનો એક યુવાન છોકરો રહેતો હતો. એક નાના ઓરડામાં જ્યાં દવાખાનું હતું, ત્યાં તે ક્રમાઉંડર તરીકે ફરજ બજાવતો હતો. એક દિવસ, આ યુવકને ગુરુદેવ અચંબિત કરી દીધો. સવારે લગભગ નવ વાગે ગુરુદેવ અચાનક આવ્યા અને બહારથી આ યુવકના ઓરડાના દરવાજાને તાળું વાસી દીધું અને પાછા તેમની કુટીરમાં આવી ગયા. કોઈને ખબર નહોતીને આ મામલો શું છે.

તે યુવકે સ્નાન નહોતું કર્યું, બપોરનું ભોજન પણ ન મળ્યું. સૂર્યાસ્ત નળછક આવ્યો, પરંતુ પૂજય ગુરુદેવ દ્વારા દરવાજે ખોલવાનો કોઈ સંકેત ન મળ્યો. છોકરાએ આખો દિવસ કર્યી પણ ખાંધું ન હતું. જ્યારે મારે તે રસ્તેથી પસાર થવાનું બન્યું ત્યારે તે છોકરો બારીમાંથી ડેકિયું કરતો હતો. તેણે મને આ બનાવ અંગેની વાત કરી પણ હું શું કરી શકું? અમારામાંથી કોઈ પણ શું કરી શકે? શું કરવું તે અમને કોઈને પણ ખબર ન પડી. અમે બધાં ચોકી ગયાં હતાં. તે યુવક પાસે નહીંવા-ધોવા માટે પાણી પણ ન હતું. તેના માથે તો જાણે આભ ફાટી પડ્યું. તે ખૂબ દુઃખી હતો.

જેમ તેમ કરી તેણે આખો દિવસ અને આખી રાત ભારે દુઃખમાં પસાર કર્યો. તે રડતો હતો અને વિચારતો હતો કે આ શું છે? આ શું થઈ ગયું?

બીજા દિવસે શ્રી ગુરુદેવ તેમના હાથમાં એક સંતરું લઈને આવ્યા. દરવાજે ખોલીને પૂછ્યું, “તું દિવસ-રાત શું વિચારી રહ્યો હતો?” “તે દિવસ અને રાતમાં કેટલી વાર ભગવાનને યાદ કર્યા?” તમારી શું કહ્યનાછે? આ યુવાન છોકરો શું વિચારી રહ્યો હશે?

યુવકે કહ્યું, “બધા પ્રકારના વિચાર કર્યો પણ ભગવાનનો વિચાર નથી કર્યો.”

“તો પણ તું એક ડાખ્લો છોકરો છે. તે એક મહાન તપ કર્યું છે.” પૂજ્ય ગુરુદેવ બોલ્યા અને તેને પ્રસાદમાં સંતું આપી દીધું.

આશ્રમના સંતો હોય કે કામદારો હોય કે સહયોગીઓ, અમારામાંથી કોઈને પણ તેમના તરફથી આવા પ્રકારનાં સખત વર્તનથી મુક્તિ નથી મળી. મને યાદ છે કે એક દિવસ કોઈ કારણસર તેમણે મને આજ્ઞા કરી હતી કે બ્રહ્મપુરી નજીક ક્યાંક એકાંતમાં જઈ સાધના-તપશ્ચર્યા કરો. જંગલમાં કોઈ ખાલી પડેલી ઝૂપડીમાં રહેવાનું. તે દિવસોમાં હું અમુક પ્રકારના કામમાં ખૂબ જ બસ્ત હતો, પરંતુ પૂજ્ય ગુરુદેવે કહ્યું “જીવ અને ત્યાં જ રહીને ધ્યાન કરો.” આ આદેશ અચાનક હતો. કોઈ પણ જીતની સૂચના વિના - તત્કષ્ણ - તત્કષ્ણ. તેઓ કોઈ દિવસ “કાલે જાઓ” તેમ ન કહેતા. તેઓ કહેતા “હમણાં જ, આ જ ધરીએ જાઓ.”

મેં કહ્યું, “ઘોંઠું કામ છે.”

જ્યારે મેં કામ વિશે વાત કરી ત્યારે પૂજ્ય ગુરુદેવ નારાજ થઈ ગયા અને બોલ્યા “કામ? કોનું કામ? શું કામ?” તેમણે કહ્યું, “કામ એટલે શું? જ્યારે કોઈ દુનિયાનું જ અસ્તિત્વ નથી તો પછી કામ ક્યાંથી હોય?” આ તે જ શબ્દો છે, જે શ્રી ગુરુદેવે ઉચ્ચાર્ય હતા. “તમારી સમક્ષ જ્યારે કોઈ જગત જ નથી. તો આ મિથ્યા જગતમાં કામ ક્યાંથી હોય?” આ શબ્દો બોલી તેઓ ચાલ્યા ગયા. તે વિષય પર ફરી મારી સાથે કોઈ દિવસ વાત નથી કરી, પરંતુ, તે કાર્યક્રમ પછીથી કેટલાંક અન્ય કારણસર બંધ રહ્યો.

ગુરુદેવ શ્રી સ્વામી શિવાનંદજી સુવર્જસમા ‘મધ્યમ માર્ગ’ના પ્રણોત્તા હતા. તેઓ તમામ વિચારો અને ક્રિયાઓમાં મધ્યમ માર્ગની ડિમાયત કરતા. તેઓ એવી વ્યક્તિની ટીકા કરતા જે આખો દિવસ તીવ્રતાથી સક્રિય રહેતી અને તે વ્યક્તિની પણ ટીકા કરતા જે આખો દિવસ કાંઈન કરતી. કોઈ પણ વાત પૂજ્ય ગુરુદેવની જાગ્ઞ બધાર ન રહેતી. એવા પણ લોકો હતા, જે જ્ય કે માણા ફેરવવા શિવાય કોઈ પણ અન્ય પ્રવૃત્તિમાં ભાગ ન લેતા. આ લોકો

ફક્ત શ્રીમદ્ ભાગવત મહાપુરાણ કે રામાયણ વાંચતા અથવા માણા ફેરવતા પણ ગુરુદેવ તેમની ટીકા કરતા. તેઓ કહેતા, “આ પ્રકારની ભક્તિ તમને કઈ ગતિ અપાવશે? આ પ્રકારની ભક્તિ તમને શું ફાયદો કરાવશે? આના બદલે ખૂબ કામ કરો. મહેનત કરો!” ભક્તિની આ પદ્ધતિને શ્રી ગુરુદેવ ‘વૃદ્ધાવન પદ્ધતિ’ કહેતા. તેઓ કહેતા, “વૃદ્ધાવન પદ્ધતિની ભક્તિ કામ નહીં લાગે. આ પદ્ધતિ યોગ્ય નથી.” તેઓ આવા લોકોની ‘માણા ફેરવવાની રીત’ની નકલ કરતા અને કહેતા કે ગૌમુખીમાં કે ઉપવશની નીચે જે હાથ ફરે છે તે ઢોંગ છે. ખોટું પ્રદર્શન છે. જે કોઈ વ્યક્તિ ખૂબ મહેનતું હોય તો ગુરુદેવ તેને કહેતા, “તમને કામનું બંધન છે, કામનું વળગણ છે. આ બંધન ખૂબ જ ખરાબ છે. કામ પ્રત્યેનો લગાવ પડા ખૂબ ખરાબ છે. થોડા જ્ય કરો, થોડો અભ્યાસ કરો અને થોડો વિશ્રામ પણ કરો” પરંતુ જે કોઈ વ્યક્તિ જ્ય જ કરે અને પ્રવૃત્તિમાં અને કામમાં ભાગ ન લેતો કહેતા કે ‘તમે આણસુ છો. તમારે કર્મયોગ કરવો જોઈએ. સખત મહેનત કરવી જ જોઈએ. તમારે પરસેવો પાડવો જ પડશે અને કામ કરવું જ પડશે.

સંતોમાં નિર્જામ કર્મયોગ અને ઉપાસનાનો સમન્વય જોવા મળે છે. તેઓ ઈશ્વર નિર્મિત આ સૂદિમાં, સર્વત્ર સમભાવે બ્રહ્મનાં દર્શન કરે છે. સંતો કઠોર સાધનાની ફલશુતિરૂપે જ્ઞાન ઉપાર્જન કરે છે. જ્ઞાનના ‘મહાસાગર’માં રૂબકી મારીને, ‘મરજીવા’ જેવા આ ગુણાતીત સંતો, ‘મોતી’ રૂપી પોતાના આત્મસાક્ષાત્કાર અને અપરોક્ષાનુભૂતિના અનુભવોની અનરાધાર વર્ણ કરે છે. આપણે ‘કિનારે’ ઊભા રહીને આપણી ક્ષમતા અનુસાર આ ‘મોતી’ રૂપી તેમના અનુભવોને જીલાવાના છે. આજે વિચારીએ તો એમ લાગે કે પૂજ્ય ગુરુદેવના જીવનની આ ગાથા કોઈ ઐતિહાસિક કે પૌરાણિક કથા અથવા ‘અરેણિયન નાઈટ્રસ’ની વાર્તા જેવી લાગે. આપણે જે પરિસ્થિતિમાં આજે જીવાએ છીએ તેનાથી તે દિવસો એકદમ જુદા હતા. ખૂબ કાદાયક દિવસો હતા - ‘પ્રતિકૂળ

પરિસ્થિતિ અને ભારે પરિશ્રમ'. ફક્ત આખાર, કપડાં અને સામાન્ય દાઢિકોણથી જ નહિ પણ બૌદ્ધિક અને ભાવનાત્મક દાઢિથી પણ ઘણા કષદાયક દિવસો હતા.

શરૂઆતના દિવસોમાં ગુરુદેવ ક્યારેય કોઈને પુસ્તક વાંચવાની મંજૂરી આપતા નહોતા. કોઈએ કેઈ પણ વાંચવું નહિ. 'કામ કરો અને સેવા કરો' - એ જ અમનો મંત્ર હતો. એક દિવસ એક સ્વામી ગુપ્ત રીતે કેલાસ આશ્રમ ગયા, પરંતુ ગુરુદેવને ખબર પડી ગઈ કે તે ત્યાં ગયાછે.

"તમે ક્યાં ગયા હતા?" ગુરુદેવ પૂછ્યું.

"હું સામે કેલાસ આશ્રમ ગયો હતો", સ્વામીએ જવાબ આપ્યો.

"શું કામ?" ગુરુદેવ પૂછ્યું.

"હું વિવેક ચૂડામણિના વર્ગમાં ગયો હતો",

સ્વામીએ ઉત્તર આપ્યો.

ગુરુદેવ તરત જ કહ્યું, "તમારા 'માથા પર શિંગડા' ઊગશે. વિવેક ચૂડામણિ ભડીને તમે તો હવે મહાન વિદ્ધાન બની ગયા છો" આમ કહી શ્રી ગુરુદેવ ત્યાંથી ચાલ્યા ગયા. પૂજ્ય ગુરુદેવનો ઈશારો ધર્મંડઅને અભિમાનદૂપી શિંગડા તરફ હતો. પૂજ્ય ગુરુદેવ વાંચનની મંજૂરી નહોતા આપતા. એવું ન હતું કે ગુરુદેવ બૌદ્ધિક શુદ્ધીકરણના કોઈ પણ પ્રયત્નની વિરુદ્ધ હતા, પરંતુ તેઓ આવા 'નવા નિશાળિયાઓ' જેવા સાધકીના મનમાં કોઈ પણ પ્રકારનો અહંકાર ધારણ કરે તે પહેલાં જ તેમને સાવધ કરતા. કોઈ પણ રીતે ભક્તોના મનના તદ્દન નાના અહંકારની ચિનગારીને પણ તેઓ તરત જ દૂર કરતા.

(અનુવાદ: ડૉ. શીતલ ઉપેન્દ્ર પારેખ)

### (આધુનિક ચુગનું માધ્યમ - ૩ પાન નં ૨૦ ઉપરથી ચાલુ)

ખૂબ જ લાભદાયક છે. આ બંને નાની પુસ્તકાઓ રોચક અને શિક્ષાપ્રદ હોવાની સાથે સાથે જીવનના ચરમ સત્યને પ્રભાવશાળી શૈલીમાં સમજાવે છે.

'Lives of Saints' અથર્વિત 'સંતોના જીવનચરિત્ર'માં મહાત્માઓનાં જીવનનાં સંકિપ્ત વૃત્તાંતો દ્વારા ભક્ત લોકોને દિવ્ય જીવન સંબંધી રોમાંચકારી ઘટનાઓ તથા ઉપાધ્યાનોથી અવગત-પરિચય કરાવવામાં આવેલ છે. સંતોનાં જીવન-ધ્યાપનને પોતાનો આદર્શ માનનારા લોકો માટે આ કૃતિઓ બહુ જ પ્રેરણાસ્પદ છે. આ સંકિપ્ત પુસ્તકમાં સ્વામીજીએ પ્રાર્થીન ભક્તોનાં જીવનને આકર્ષક અને પ્રશિક્ષાપ્રદ સરળ તથા સ્પષ્ટ શૈલીમાં રજૂ કરીને તેમને પુનર્જીવિત કર્યા છે. તેમની આ સફળતા પરેખર સ્પષ્ટનો વિષય છે.

લોકોની રુચિઓ તો બિન્ન બિન્ન હોય છે. એટલા માટે સ્વામીજીએ થોડા લોકોની રુચિને અનુકૂળ બનાવવા માટે ધર્મના વિવેચનને વાતાવાપના રૂપમાં 'Dialogues from the Upanishads' and 'Conversation in Yoga' (ઉપનિષદોના સંવાદ તથા

યૌંગિક વાતાવાપ) પુસ્તકોમાં પ્રસ્તુત કરેલ છે. આ પ્રકારની રચનાઓની એ વિશેષતા છે કે આમાં પ્રશ્નોત્તર શૈલી અપનાવીને સાધકોની સમસ્યાઓ અને શંકાઓના સમાધાનને ખૂબ જ સુંદર રૂપે દર્શાવવામાં આવ્યું છે. જિજાસુઓ દ્વારા કરવામાં આવેલ અનેક પ્રશ્નોના ઉત્તર સહિત સાધકો સુધી પહોંચાડવા માટે આ પુસ્તકોની રચના કરવામાં આવેલ છે.

પ્રેરણાસ્પદ પત્રોનો કમબદ્ધ સંગ્રહ સ્વામીજીની રચનાઓનો પાંચમો પ્રકાર છે. આ પણ તેમની અમૃત્ય કૃતિઓમાંથી એક છે; કરણ કે આમાં દેશના ચારેય ખૂબોથી અલગ અલગ રુચિઓ ધરાવતા લોકોના પત્રો અને સ્વામીજી દ્વારા આપવામાં આવેલા ઉત્તોનું તેમાં સંકલન છે. આમાં સંશય નિવારણ, સમસ્યાઓનાં સમાધાન, મુશ્કેલીઓનાં નિરાકરણ, ઉપચારો માટેના ઉપયોગ, પરસ્પર સમજણ તથા પ્રેરણાસ્પદ ઉપદેશોનો સમાવેશ તેની મેળે જ થઈ ગયો છે.

□ 'પ્રકાશપુર્જ' માંથી સાભાર

## દ્વારાનસ્થ દર્શનઃ સ્વયંથી પ્રશ્ન સ્વયંને પ્રત્યુત્તર

ડૉ. નાનકભાઈ ભડ્કારી

ભાષા અને માનવ મસ્તિજ્જના વિકાસની વિગતો તપાસતાં જગ્જાય છે કે મનુષ્ય જગતે બાહ્ય અવલોકનોને કાર્યકારણ સાથે જોડવા તર્કનો સહકાર લીધો છે અને જે બનાવો તર્કથી સમજવામાં મુશ્કેલ જગ્જાય છે ત્યાં ફિલસ્ફૂરી (તત્ત્વજ્ઞાન)નો આશ્રય દેવામાં આવે છે. એક દાખિકોશાથી તત્ત્વજ્ઞાન માનવ સ્વભાવના અહંકું પ્રતિકલન (રિએક્શન) છે. તત્ત્વજ્ઞાનને સામાજિક, ધાર્મિક અને અધ્યાત્મ મૂલ્ય આપી મનુષ્ય પોતાના તર્કને વધારે યથાર્થ ગણ્ણાવી રહ્યાનું જોવા મળે છે.

જોકે અધ્યાત્મના માર્ગે સહજ વિનાની પોતાના આસ્તિત્વને પણ જેઓએ મિટાવ્યું છે તેવા કબીર, રામકૃષ્ણ પરમહંસ, રમણ મહર્ષિ કે પાનબાઈએ જીવનનાં રહસ્યને અત્યંત સરળતાથી તર્ક અને દર્શનના આધાર વિના માપી દેખાડ્યા છે.

ભક્તિ, કર્મ અને જ્ઞાનમાર્ગ મનુષ્યના આચરણથી દર્શિત કરવામાં આવે છે પરંતુ કર્મ તરીકેની ભાવ પ્રક્રિયા દરમિયાન મનુષ્યનાં શરીરમાં જે રાસાયનિક ફેરફાર થાય છે તેની વૈજ્ઞાનિક જગ્જા આપણી પાસે નથી. કક્ષ, પિત અને વાયુ એ ખોરાકની જ રાસાયનિક આડપેદાશ છે અને નિશ્ચિત રીતે શરીરમાં બદલાવ લાવે છે. આ ફેરફારથી શરીર જે અનુકૂળતા-પ્રત્યકૂળતા અનુભવે છે તેની સ્પષ્ટ નોંધ ચરકસંહિતા પ્રકારના આધારમાં ઉપલબ્ધ છે.

યોગ પ્રક્રિયામાં ગ્રાણવાયુના વિશેષ ઉપયોગથી મનુષ્ય શરીરની ઊર્જાનું સ્તર બદલાય છે. આ વિગતો હવે કેરોલીન ફોટોગ્રાફ અથવા સ્કેનિંગ દ્વારા સ્પષ્ટ જોઈ શકાય છે પણ આ જ પ્રક્રિયા થકી મનમાં ઉદ્ભવતા શાંતિ અને આનંદભાવ પાછળ રહેલા રાસાયનિક બદલાવને હજુ અંકિત કરાયાનું જાણમાં નથી.

વિજ્ઞાનનું ક્ષેત્ર હવે માનવ મસ્તિજ્જની ગ્રૂપ ઉકેલવા ઠીક-ઠીક સમર્થ બની રહ્યું છે ત્યારે શાંતિ અને આનંદના સાતત્યથી મળતા મોક્ષ-નિવાણી પ્રકારના ભાવ પાછળ રહેલ રાસાયનિક બદલાવનું અંકન કરવું જોઈએ. ઈલેક્ટ્રો-મેનેટિક વેકા પાછળ રહેલ સાઉન્ડ વાઇદ્ઝેશન

દ્વારા શરીરમાં થતા રાસાયનિક ફેરફાર વિષયે હજુ સમજવાનું બાકી રહે છે.

જોકે શરીરનું શાશ્વત આનંદ સ્વરૂપ તો “ઈલેક્ટ્રો-મેનેટિક ડેમેસ્ટ્રી” બને જ છે. આથી વિજ્ઞાનની મદદથી માનવ શરીરને સમજવું જોઈએ. જ્યાં સહભાગીય અવલોકન (participative observation) નિષ્ફળ ગયું છે. ત્યાં તર્કનો વિકાસ થયો છે. જ્યાં તર્ક નિષ્ફળ ગયો છે, ત્યાં ફિલસ્ફૂરી વિકાસ પામી છે અને ફિલસ્ફૂરી પ્રશ્નોનું નિરાકરણ આપી શકતી નથી. ત્યાં વિજ્ઞાન અને તકનિક આખરી બને છે. આથી ૨૧મી સદીએ અગ્રાઉન્ડાં બે ક્ષેત્રોને છોડી દેવાં જોઈએ અને જીવનશાખાને નવા દાખિકોશાથી માપવું જોઈએ. જૂના માપદંડને ગૌરવ તરીકે ક્રાંતિ સુધી પકડી રાખીશું? જૂના પરિમાણથી સમાજનું અંકન કરતાં રહીશું તો પછીતપણું કાયમ રહેશે અને અહંના ગુણગાન ગવાતાં રહેશે.

તાર્કિક રીતે તો અનું સમજાય છે કે પૂર્વજન્મ જેવું કંઈ નથી. વ્યક્તિનું આસ્તિત્વ ફરી જેમનું તેમ પ્રગટ થાય તેવું નથી. તેમ આસ્તિત્વ સ્વર્ગ-નરકમાં પુષ્પ-પાપના આધારે પહોંચે છે તેવું પણ કંઈ નથી. વૈજ્ઞાનિક તથ્ય જગ્જાવે છે કે પુસ્તકવધનાં ઓ-પુસ્તકના જિન્સમાંથી નવા માનવપિંડ બને છે. રંગસૂત્રની શોધ અનુસાર પ્રત્યેક વ્યક્તિમાં તેની માતાના પણે બીજા ઉંઘ્યા વ્યક્તિ અને પિતાના પણે બીજા ઉંઘ્યાના જિનેટિકલ લક્ષણ (સંસ્કાર) સંગ્રહિત થયેલ હોય છે. આમ, પૂર્ણી પર અવતરણ પ્રત્યેક ભાગક પોતાની માતા અને પિતા પણે ૭-૭ અને પોતે સ્વયં એક તેમ ૧૫ વ્યક્તિઓની સરેરાશ ઉપર્યુક્તાના અનુભવ સાથે જીન્યે છે.

મૃત્યુ પામતી વ્યક્તિ પોતાની રચનાત્મકતામાંથી મળેલ આનંદ અને શાંતિની ઊર્જાની સાથોસાથ પોતાના કર્મથી મેળવેલ દુઆ અથવા તિરસ્કાર ભાવનાની ઊર્જા વર્તુળને સાથે બાંધી શેતન્યુરૂપે સફર પ્રારંભે છે. મૃત્યુ

અનુસંધાન પાનં નં ૨૬ ઉપર

## તेरा તુજકો અર્પણ, કચા લાગે મેરા !

શ્રીમતી રૂપા મજુમદાર

એક વખત પૂજયપાદ શ્રી સ્વામી અધ્યાત્માનંદજી મહારાજ ગુરુભગવાન શ્રી સ્વામી શિવાનંદજી મહારાજ સાથે અધ્યાત્મયાત્રા અર્થે ટ્રેનમાં પ્રવાસ કરી રહ્યા હતા. કોઈ બાંધકામના કારણે આકસ્મિક ટ્રેન રસ્તામાં ખાસો સમય ઉલ્લભી રહી. ત્યાં કામ કરતા મજૂરોનાં નાનાં બાળકો એક તૂટેલી પાઈપલાઈનમાંથી પાણીનો હુંવારો ઉડતો હતો તેમાં આનંદકિલ્લોલ કરતાં છબછબિયાં કરતાં નાહી રહ્યા હતાં. ગુરુમહારાજે સ્વામીજીને કોઈ ભક્તે બેમને આપેલી સ્વીસ - જર્ઝન ચોકલેટ બાર લઈ જઈ એ દરેક બાળકને આપવાનું કહ્યું અને કહ્યું કે, ‘જ્યારે બાળકો ચોકલેટ હાથમાં લે ત્યારે તેમની આંખો નિહાળજો.’ સ્વામીજી મહારાજે આ પ્રસંગે સ્વયંનો અનુભવ વ્યક્ત કરતાં કહ્યું કે, ‘નિર્દ્દીષ બાળકોના હાથમાં ચોકલેટનો આટલો મોટો બાર આવતાં તેમની આંખો પહોળી થઈ ગઈ. હરણ જેવી વિશાળ આંખોમાં જાણે ચમકારો થયો અને ઈશ્વરની જલક એ પ્રત્યેક બાળકનાં પ્રસન્ન વદનમાં થઈ.’ વાત નાની છે પણ અનુભૂતિ મહાન છે. આનંદ અનેરો છે. કોરોનાકાળમાં લોકડાઉનમાં પણ પૂજયપાદ સ્વામીજીની અધ્યક્ષતામાં આપણા આશ્રમમાં દરિદ્રનારાયણ સેવા અવિરતપણે ચાલુ જ રહી છે. અંતરિયાળ વિસ્તારોમાં જઈ આપણા આશ્રમ તરફથી અનેક પરિવારોને પૂરતી માત્રામાં ખાદ્યસામગ્રી પહોંચાડવામાં આવી. સ્વામીજી મહારાજ માટે ‘સેવા’ એ મહાયજ્ઞ અને ‘આપવું’ એ મહાકાર્ય છે.

સદ્ગુરુદેવ શ્રી સ્વામી શિવાનંદજી મહારાજનું સૂત્ર છે, ‘આપો, આપો અને બસ આપો.’ ‘Send spend spend, HE will send send send.’ આપણે આપીશું તો બે હાથથી આપીશું, આપવાવાળો હજ્જર હાથવાળો છે, વરસશે. બસ, આપવાનું ચાલુ તો કરો. આ જગતમાં જે અસમતુલા દેખાય છે તેનું કારણ જ છે -

‘પરિગઢ’. બધાંને વધુ ને વધુ જોઈએ છે પણ આપવાની ભાવના ઘણાં ઓછામાં છે. જેમની પાસે ઘણું છે તે છોડવા માગતા નથી. એવી કેટલીય વસ્તુઓ છે, જે આપણે વરસમાં એક વાર પણ વાપરતા નથી, છતાં પણ જેને તેની જરૂરિયાત છે તેને ખુલ્લાં મનથી આપી શકતા નથી.

ગુરુદેવના ઘરંગયોગમાં પહેલાં ત્રણ અંગ છે - સેવા, પ્રેમ અને દાન. આ બહિરંગ છે, જેમાં ‘આપવાની’ ભાવના છે. સેવા આપો, પ્રેમ આપો, દાન આપો. ત્યારબાદ જ પછીનાં ત્રણ અંગ - જે અંતરંગ છે - પવિત્રતા, ધ્યાન અને સાક્ષાત્કારની ઉપલબ્ધિ થશે. જ્યારે આપવાની વાત આવે છે ત્યારે સ્વામીજી મહારાજ કહે છે, ‘તમારી પાસે જે શ્રેષ્ઠ છે, તે આપો. જૂનું-પુરાણું, ઊતરી ગયેલું, વાસી થઈ ગયેલું અન્ન કે વસ્તુઓ ન આપો. ગ્રહણ કરનાર બ્યક્સિ પ્રેમથી તે વાપરી શકે તેવું આપો.

કઠોપનિષદ્ધમાં નિચ્ચિકેતાના પિતાશ્રીએ મોટો પણ કર્યો અને તેની પૂર્ણાંહૃતિ પછી જ્યારે દાન આપવાની ઘડી આવી ત્યારે તેમણે બ્રાહ્મણને વસ્તુકી ગયેલી ગાયો દાનમાં આપવા માંડી ત્યારે બાળક નિચ્ચિકેતા તેના પિતાને કહે છે ‘પિતાશ્રી, આવી ગાય દાનમાં આપવાથી તો ઊલટાનું તમને પાપ લાગશે. પજનો ઉદેશ સિદ્ધ નહીં થાય. કંઈક શ્રેષ્ઠ આપો !’ ત્યારે ગુસ્સે થયેલા પિતાશ્રીથી બોલાઈ ગયું કે, ‘જા ! હું તને ધમરાજાને દાનમાં આપું છું.’ ધમરાજાના દ્વારે ઊભેલા નિચ્ચિકેતાનું સ્વરૂપ, ભાવના અને દર્શન સંકલ્પબળ જોઈ તેઓ તેને દુર્લભ ‘આત્માનું જ્ઞાન’ પ્રદાન કરે છે. ભલે ! આ જગતમાં આપજને એક વસ્તુ પર એક વસ્તુ મફતમાં મળે છે, પણ સૂક્ષ્મ જગતનો કાયદો અલગ છે. ત્યાં ‘એકની સામે અનેકગણું’ આવીને મળે છે. માટે

આપણે શું આપવું છે તે આપણે નક્કી કરવાનું છે - જે નક્કી કરવાનો હક પણ આપણને આપવામાં આવો છે. સારા, મહુર, કોઈની ચેતનાને સાંત્વના આપતા શબ્દોનો ઉપયોગ કરવો છે કે કોઈને હુઃખી, અપમાનિત, હડ્ધૂત, નિંદા, કટાક્ષ કરતા શબ્દોનો ઉપયોગ કરવો છે? કોઈને પ્રેમાળ, લાગણીસભર સ્પર્શ કરવો છે કે એ વ્યક્તિ આપણાથી દૂર થઈ જાય એવો પક્કો મારવો છે? આપણે સૌને ગમતા રહીએ અને કોઈ આપણું થઈને રહે એવું વર્તનિ કરતું છે કે સૌ હદ્યથી આપણાથી દૂર થઈ જાય એવું વર્તનિ કરવું છે?

સદ્ગુરુદેવ શ્રી સ્વામી શિવાનંદજી મહારાજ તો 'SIVANAND' ના બદલે 'GIVANAND' કે 'SEWANAND' ને નામે જ ઓળખાતા. લોકો તેમને ધર્મરાજ રહેતા. ગુરુદેવ જેને જે જોઈતું હતું તે આપ્યું છે. ક્યાંય કસર કરી નથી, ગુરુદેવ કહેતા, 'જે ઉપવાસ કરે છે, તે પ્રભુના માર્ગ છે. જે પ્રાર્થના કરે છે, તે પ્રભુના બારણો છે. જે દાન આપે છે, તે પ્રભુના ખોળો છે, માટે આપો, આપો અને બસ આપો.' અન્ન, વસ્તુઓ, કપડાં તો આપવાના જ છે પણ પ્રેમ આપો, શાંતિ આપો, આનંદ આપો, ખુશી આપો, સોહ આપો, નવજીવન આપો, કરુણા આપો, અભયદાન આપો, કંમા આપો, સાંત્વના આપો, સહાનુભૂતિ આપો - આ બધું જ આપો. આપવાથી જ આપણો આત્મા ઉન્નત બનશો અને લક્ષ્યની પ્રાપ્તિ થશે જ.

આપણે જ્યારે કોઈને મદદ કરીએ છીએ ત્યારે આપણી અપેક્ષા એમ રહે છે કે મેં તેને મદદ કરી એટલે મારે જરૂર હોય ત્યારે એણે મને મદદ કરવી જોઈએ અને

જ્યારે એવું બનતું નથી ત્યારે આપણે હુઃખી થઈ જઈએ છીએ અને આપણી આપવાની ભાવના મોળી પડતી જાય છે પરંતુ યાદ રહે 'કરેલી સેવા અને આપેલા દાન' ક્યારેય નિષ્ઠળ જતાં નથી. તેનો બદલો કોઈપણ સ્વરૂપે આવીને મળે જ છે. આવશ્યક નથી કે તમે જેને મદદ કરી તેના તરફથી જ મદદ આવે, ક્યાંયથી પણ, અનપેક્ષિત જગ્યાએથી પણ મદદ આવી શકે. આપણે બેંકમાં જમા કરાવેલા પૈસા ઉપાડવા જઈએ ત્યારે જમા કરાવ્યા તે વખતે જે નંબરની નોટો આપી હતી, તે જ નોટો પાછી મળતી નથી. આપણું દાન પરમાત્માના ચોપે જમા થઈ જાય છે અને આપણને જરૂર હોય ત્યારે ચોક્કસ કોઈપણ માધ્યમથી પાછું મળે જ છે - તે પણ અનેકગણું થઈને - માટે આપો, આપો અને બસ આપો.

જીવનનો આનંદ છે ..... આપવાનો આનંદ ..... સેવાનો આનંદ ..... પ્રેમ કરવાનો આનંદ ..... પ્રાર્થનાનો આનંદ ..... ધ્યાનનો આનંદ ..... વહેચાવાનો આનંદ ..... જીવન એક એવી નિશાળ છે, જેમાં દરેક હુઃખ, દરેક વધા, દરેક હતાશા કીમતી પાઠ શીખવે છે. 'આપવાથી' અખૂટ સંતોષ, બળ અને આનંદ માખ થાય છે, જે બધી મુશ્કેલીઓને બહાદુરીથી હટાવી દે છે.

'લેવું છે, લેવું છે'ની ઈચ્છામાં આપણું આનંદ સ્વરૂપ તિરોધાન થઈ ગયું છે. 'આપવાના' અલ્યાસથી પુનઃ આનંદ સ્વરૂપમાં પ્રતિષ્ઠિત થઈએ અને આનંદનો સાક્ષાત્કાર કરતાં ગાઈએ -

'તેરાતુજુકો અર્પણ, ક્યા લાગે મેરા!'

માનવ-મનના ગુણો-અવગુણોને ગુરુ ખૂબ જ સારી રીતે જાણો છે. તેથી જ તો તેઓ ગુરુ છે. ગુરુને જાણો છે કે શિષ્યનાં ચેતન-અચેતન મનમાં કેવો વંટોળ મચ્છી રહ્યો છે. ગુરુ બંને અવસ્થામાં શિષ્યની સમસ્યાઓનું સમાધાન હુંછે છે. અજ્ઞાનનો મૂળ ઝોત અચેતન મનમાં છે, માટે મકાશનું કિરણ પણ ત્યાંથી જ પ્રગટે છે.

- સ્વામી અધ્યાત્માનંદજી

$$\text{ॐ} = mc^2 \quad (\text{E} = mc^2)$$

- શ્રી અતુલ પરીખ

વિશ્વ વિભ્યાત નોંબળ પારિતોષિક વૈજ્ઞાનિક ડૉ. આલ્બર્ટ આઈન્સ્ટાઇને  $E = mc^2$  સમીકરણ આપીને વિજ્ઞાન જગતને એક નવી દિશા પ્રદાન કરી, કે જેણે માનવ સંસ્કૃતિના ઉત્કાંતિમાં અદ્વિતીય ફાળો આપ્યો છે.

$E = \text{Energy}$  - શક્તિ/ઊર્જા       $m = \text{mass}$  - દ્રવ્ય  
 $c = \text{પ્રકાશની ગતિ}$  ( $1,86,000$  માઈલ/સેકન્ડ)  
 $\text{અં} = \text{યુનિવર્સલ એનર્જી}$

મહત્તમ શક્તિ યા ઊર્જા મેળવવા જો અણુને ન્યુક્લિયર પાવર ખાનટમાં તોડવામાં આવે તો તે દ્વારા અકલ્યનીય ઊર્જાઓ ઉત્પન્ન થઈ શકે. આના એક દાખાંતરૂપે જે એક ગ્રામ પાણીને શુદ્ધ ઊર્જામાં  $E = mc^2$  ના સમીકરણ પ્રમાણે રૂપાંતરિત કરવામાં આવે તો  $20,000$  ટન - TNT વિસ્કોટ જેટલી ઊર્જા ઉત્પન્ન થઈ શકે. આ સમીકરણ દ્વારા આઈન્સ્ટાઇને Quantam Physics (પરિમાણ ભૌતિક વિજ્ઞાન) દ્વારા ઊર્જા અને દ્રવ્ય વચ્ચેના પારસ્પરિક સંબંધો વિષે નવા સિદ્ધાંત તેમ જ નવી સંભાવનાઓ માટેનાં દ્વાર વિશ્વ સમજ ખુલ્લાં કર્યા. આ દ્વારા આઈન્સ્ટાઇને ન્યુક્લિયર ઊર્જા, ન્યુક્લિયર મેડિસીન તેમજ બીજી અનેક સંભાવિત ટેકનોલોજી માટેનાં દ્વાર ખુલ્લાં કર્યા. ક્વોન્ટમ વિધરી દ્વારા તેમજો નવો સિદ્ધાંત આપ્યો કે દ્રવ્ય યા મેટર અને ઊર્જા યા શક્તિ બંને એકબીજાથી અલગ નથી. એટલે કે દરેક અણુમાં અનંત ઊર્જા સંભાવિત છે. બે દ્રવ્ય વચ્ચેના જીવ્યાનો ગર્ભિત સંબંધ ગુરુત્વાકર્ષણના અધિનિયમ તેમ જ ઈલેક્ટ્રો મેનેટિક રેડિએશન દ્વારા સ્થાપિત થાય છે.

આઈન્સ્ટાઇને આ સમીકરણ દ્વારા એવું ફલિત કર્યું કે જેમ દ્રવ્યમાં સંભાવિત અનંત શક્તિ યા ઊર્જા છે, તે જ પ્રમાણે અદ્ય શક્તિમાંથી દ્રવ્ય ઉત્પન્ન કરી શકાય. વિશ્વમાં કુલ દ્રવ્યનો જીવ્યો એક સરખો છે પરંતુ તેમાં રહેલી અનેક સંભાવનાયુક્ત શક્તિ નિત્ય ચલિત છે. વાસ્તવમાં બ્રહ્માંડ પ્રકાશની ગતિથી પણ વધારે ગતિથી અવિરત વિસ્તૃત થઈ રહ્યું છે. તેમજ બ્રહ્માંડમાં સમસ્ત ઊર્જાનું હંમેશા રૂપાંતર થયા કરે છે. આ વैશ્વિક શક્તિ યા કોસ્મિક એનર્જી અલગ અલગ સ્વરૂપમાં જોવામાં આવે છે. દ્રષ્ટાંત તરીકે

ઈલેક્ટ્રો મેનેટિક તરંગોનો પ્રવાહ જે પ્રકાશની ગતિ સાથે ફેલાય છે ( $1,86,000$  માઈલ/સેકન્ડ). આ પ્રકાશના તરંગોનો પ્રવાહ એક મોઝાંની જેમ હોય છે. દા. ત. રેડિયો વેવ, માઈક્રો વેવ, ઇન્ફરેડ વેવ, અલ્ટ્રાવાયોલેટ રેડિએશન, ગ્રામ વેવ વગેરે.

ક્વોન્ટમ ફિલ્ડિંગ્સ એ વસ્તુ યા દ્રવ્ય અને ઊર્જા વચ્ચેના પારસ્પરિક સંબંધોની માહિતી આપે છે. અણુ ઊર્જા એ દ્રવ્ય બંધારણના પાયામાં છે. અણુ એ દ્રવ્યનો નાનામાં નાનો પાર્ટિકલ કે તેથી વિશેષ તેનું વિભાજન અશક્ય છે. આ અણુની અંદર સમાહિત ન્યુક્લિયરની આસપાસ ઈલેક્ટ્રોન અને પ્રોટોન એક ચોક્કસ બ્રમજ ક્ષામાં સતત બ્રમજ કરે છે. જે વસ્તુ આપણાને નરી આંખે સ્થિર દેખાય છે તેના દરેક અણુમાં ઈલેક્ટ્રોન અને ન્યુટ્રોન તેના ન્યુક્લિયરની બ્રમજ ક્ષામાં એક સેકન્ડમાં  $7,000$  ટ્રીવિધિની ગતિથી સતત બ્રમજ કરે છે. એટલે કે  $2,200$  કિલોમીટર/સેકન્ડની ગતિથી ફરે છે. આ ગતિથી માત્ર  $1/8$  સેકન્ડમાં પૂઢ્યીની પરિક્રમા પૂરી થાય. જે રીતે સૂર્યમંડળમાં ગ્રહો તેની ક્ષામાં લાખો વર્ષથી સૂર્યની આસપાસ બ્રમજ કરે છે. તે જ સિદ્ધાંતના આધારે અણુની રચના થયેલ છે.

માનવ શરીર અબજો કોષોનું બનેલું છે અને તેમાં પણ સતત વિદ્યુત ચુંબકીય તરંગો (ઈલેક્ટ્રો મેનેટિક વેવ) ઉત્પન્ન થયા કરે છે. મનમાંથી ઉદ્ભબવતો દરેક વિચાર મગજમાંથી લાખો વિદ્યુત ચુંબકીય તરંગો પ્રવાહિત કરે છે. આપણા મનમાં ઉદ્ભબવતો વિચાર પણ એક શક્તિ પુંજ છે અને આ વિચારની ગતિ પ્રકાશના તરંગની ગતિ કરતા ઘણી વધારે છે. આપણાં વેદ-વિધાન પ્રમાણે જગતએ માત્ર એક વિચાર અથવા કલ્યાણા છે. શરીરના અંગોમાં રહેલ દરેક કોષ તેના કાર્યનું સંપૂર્ણ જ્ઞાન ધરાવે છે. તે જ પ્રમાણે શરીરમાં રોજ અબજો નવા કોષોની પ્રક્રિયા સતત ગતિશીલ છે. તેમ જ આ કોષોમાં પણ તેની કાર્ય રચનાનો ડાટા તેમાં સામેલ હોય છે. દા. ત. લીવર, હોજરી, કિડની, હદ્દી વગેરે દરેક અંગોમાં સ્વયં

સંચાલિત રીતે તેમના કાર્ય કરે છે.

વિશ્વમાં કોઈ પણ વસ્તુ સ્થિર નથી પણ સતત  
ચલિત છે; તેમ જ તે શાશ્વત નથી પણ નાશવંત છે.  
પ્રલાંડમાં અભજો તારા અને કરોડો સૂર્યમંડળ એ સર્વ એક  
ચોક્કસ વિદ્યુત ચુંબકીય શક્તિ દ્વારા તેના નિયત ક્ષેત્રમાં  
પરિભ્રમણશીલ છે. આણુથી માર્ગને આણું પ્રલાંડ માત્ર  
એક જ શક્તિ દ્વારા સ્વયં સંચાલિત છે. આ એક રહસ્ય  
શક્તિ કે જેને વૈશ્વિક ચેતના કહી શકાય કે જે શક્તિ આખા  
પ્રલાંડમાં વ્યાપ્ત છે. તેમ જ એક નાનામાં નાના અણુમાં  
પણ તે શક્તિ સમાપેલી છે. તે જ પ્રમાણે આ શક્તિ  
આપણા શરીરના દરેક ક્રોષમાં સમાપેલ છે. તેથી જ  
આપણા વેદમાં “અહમ્ પ્રલાસિ” એટલે કે હું પ્રલાંડનો  
અંશ છું. આ દિવ્ય ચેતના શક્તિને વેદાંતમાં સર્વસ્વ,  
સર્વવ્યાપી અને સર્વજ્ઞાની તરીકે વર્ણવવામાં આવી છે.

કવો-ન્ટમ હિલિક્સ, કવો-ન્ટમ લાઈટ અને કવો-ન્ટમ રેડિયેશનના સિદ્ધાંતો ઉપર એક દાખિ એટલે કરી કે તેનો સીધો સંબંધ આધ્યાત્મિક વિજ્ઞાન (Meta-Physics) જોડે છે. મેટા હિલિક્સ યા આધ્યાત્મિક વિજ્ઞાનની એક

પેટાશાખા ઉદ્ભવી છે કે જેને Ontology (ઓન્ટોલોજી) કહે છે. ઓન્ટોલોજીનો અનુવાદ ‘પંચીકરણમું વિદ્યા’ થાય. આધ્યાત્મિક વિશ્લાન અસ્તિત્વ શું છે અને તેનો વિશ્શે સાથે શું સંબંધ છે યા હું કોણ હું તેમ જ અસ્તિત્વનું સનાતન સત્ય શું છે વગેરે પ્રશ્નોની છણાવટ કરે છે. પંચીકરણમું વિદ્યા એટલે કે પંચમહાભૂતના મિશ્રણ દ્વારા સર્જિત આપું જગત અને જીવ વિશેનો તત્ત્વાર્થ. આ વિષે આદિશંકરાચાર્યજીએ ‘પંચીકરણમું’ પુસ્તકમાં વિસ્તૃત સમજ આપી છે.

The whole universe is field of energy and information. એ જ પ્રમાણે આપણું ભૌતિક અને સૂક્ષ્મ શરીર પણ ચૈતસિક શક્તિ અને માહિતીથી પૂર્વ છે. આપણે હજુરો વર્ધથી શક્તિની ઉપાસના અલગ અલગ સ્વરૂપમાં કરીએ છે. જેમકે નવરાત્રીમાં નવ દિવસ મા હુર્ગાની સુતિ તેમજ મા અંબા-મા કાલી, મા ગાયત્રી તેમજ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ દેવતાઓની પવિત્ર શક્તિનં આપણે આવાહન કરીએ છીએ.

વધુ આવતા અંકે સૌજન્ય : નવગુજરાત સમય

(દ્વાનરસ દર્શનઃ સ્વયંથી પ્રશ્ન સ્વયંને પ્રત્યુત્તર પાન નં રૂપ ઉપરથી ચાલુ)

પછી માણીમાત્રની અવસ્થાને એનર્જી બોલ તરીકે કલ્પિશું  
તો જ્ઞાશે કે ઊર્જા સંકુલ પોતાના રંગસૂત્રના આંદોલન  
અનુસાર પુનઃ શરીર ધારણ કરવા સ્વતંત્ર રહે છે, કોઈ ઊર્જા  
પોતાના જીવનકાર્યને બળવતાર બનાવતા સમુદાય સાથે  
પ્રેરણારૂપે રહે છે તો કોઈ ઊર્જા અન્તમાં ભલી જાય છે જેને  
દર્શનશાસ્ત્ર મોક્ષ અથવા નિવાણ કરે છે.

પ્રોસેસ ઓફ નેચરલ સિલેક્શનથી થતો વિસ્તાર તર્કબદ્ધ લાગે છે, પરંતુ એ વાત પણ તાર્કિક જગ્યાય છે કે અસ્ટિટ્વ વહેંચાયા કરે છે, સમાપ્ત થતું નથી. માણસના મસ્તિષ્ણની સમજ પંચમહાભૂતના સંદર્ભમાં જ વિઘમાન છે, આથી સ્વૃથ શરીરથી પર પણ કંઈક હોઈ શકે છે તેમ કલ્યાના કરવાનું મુશ્કેલ છે. અસ્ટિટ્વ દેખાય છે, પરંતુ અસ્ટિટ્વનો નાશ થયા પછી પંચેન્દ્રિય તેની પ્રતીતિ આપી શકતું નથી અને માત્ર મસ્તિષ્ણના જે ભાગો હિલેક્ટ્રો મેળેટિક વાઈબ્રેશન પકડી શકે છે ત્યાંથી જ કંઈ આજસાર

મેળવવાનો રહે છે. સ્વર્ણ આ સ્થિતિની એક વૈજ્ઞાનિક સાભિતી બની રહે છે, પરંતુ સ્વર્ણની મયર્યાદા એ છે કે તે વૈધકિતા છે, જીગૃત અવસ્થામાં શક્ય નથી. તેનું દસ્તાવેજું કરાજ પણ શક્ય નથી.

આ સ્થિતિ વચ્ચે ધ્યાન એક એવું ભાધ્યમ છે કે  
પંચેન્દ્રિયની હ્યાતી વચ્ચે જીગૃત અવસ્થામાં માણસ  
ચૈતન્યના સ્વરૂપ અને ગતિના દ્રષ્ટા બની શકે છે જોકે  
અહીં ફરી એક મર્યાદા એ પહોંચે છે કે આ બાબતોની  
અભિવ્યક્તિ અ-વ્યક્ત છે. ગ્રાહીજગતને ઇન્ડિય છે  
અને અસ્સિસ્ટન્સના આનંદ-શાંતિના પરમ ઉદેશને સદેહે  
પણ અવતરિત કરી શકાય છે. આથી જ ભક્ત કર્યિ  
નરસિંહ મહેતાએ પણ ગાયું છે, આપણે આપણો ધર્મ  
સંભાળવો અને કર્મનો મર્મ લેવો વિચારી. અથાર્તુ જ્યાં  
છીએ તે સ્થિતિ-મર્યાદાના વર્તુળમાં રહી આનંદિત  
રહેવું. માનવદેહ શાંત અને આનંદિત રહેવું એ જ  
એકમાત્ર હ્યાથવગો (ઉપાય છે).

## મારા પ્રત્યુત્તર

- ગુરુદેવ શ્રી સ્વામી શિવાનંદજી

જો આત્મા અમર હોય તો સ્વામીજી, શરીરની સાથે જોડાયેલી તમારી જન્મતિથિ તમે શા માટે ઊજવો છો?

હું મારી જન્મતિથિ ઊજવતો જ નથી. ભક્તો તેની ઉજવણી કરે છે. આવા જન્મદિનની ઉજવણી પરબ્રહ્મની પૂજા સમાન છે. ગુરુની પૂજા તે પરબ્રહ્મની પૂજા છે. ભક્તોને ગુરુના જન્મદિનની ઉજવણીમાં આનંદ આવે છે. તેનાથી તેમને લાભ થાય છે અને ઉન્નત બને છે. દર વર્ષ જ્યારે જન્મદિનની ઉજવણી થાય છે ત્યારે એક આધ્યાત્મિક મોજું ઉદ્ભબે છે અને વધુ ને વધુ માનવોને દિવ્ય જીવન સંધ અને મારા ઉપદેશોને જાણવા તથા સમજવાનો લાભ મળે છે. જન્મદિનની ઉજવણીથી ભક્તોને દર વર્ષ તેમના જીવનનો સાચો ઉદેશ શું છે તે યાદ અપાવવામાં આવે છે. તેમની સાધનામાં આ ઉજવણી પ્રેરણા આપે છે. આવા પ્રસંગે પ્રગટ્યો પવિત્ર અને ગ્રહણશીલ ભાવ ભક્તોને ગુરુ અને ઈશ્વરની કૃપા તરફ લઈ આપ છે. જન્મદિનની ઉજવણી પ્રસંગે જેગા મળેલા અસંખ્ય ભક્તોએ દરશિવિલા શાંતિ, પ્રેમ, ભક્તિવાળા વિચારો તે પ્રદેશમાં શાંતિ, સંવાદિતા અને આધ્યાત્મિક વાતાવરણને પુષ્ટ કરે છે.

હિંદુઓ, ધાર્મિક અગ્રગણ્યો, સંતો અને ઋષિ મુનિઓ જેવા કે બુદ્ધ, શંકર, મહાવીર વગેરેની જન્મજ્યંતી ઊજવે છે તે કંઈ હેતુ વગર ઊજવતા નથી. હિંદુ પંચાંગમાં આવી ઘણી જન્મજ્યંતી અને તહેવારો હોય છે. આ જન્મજ્યંતી અને તહેવારોની ઉજવણી લોકોને જરૂરી આધ્યાત્મિક પ્રેરણા આપે છે અને તેઓ વધુ ને વધુ ખંતથી જીવનના ઉદેશ-આત્મસાક્ષાત્કારની પ્રાપ્તિ માટે ખૂબ પ્રયત્ન કરી શકે છે. જેમ આવા ખાસ પવિત્ર દિવસો વધારે તેમ આપણી આધ્યાત્મિક પ્રગતિને બળવત્તર કરવા માટે પ્રોત્સાહિત થવાની વધુ સંભાવના છે.

સાક્ષાત્કાર પામેલા આત્માએ ફક્ત પોતાનો જ મોકા મેળવ્યો હોવાથી તેને સ્વાર્થ ન ગણાય? જો બધા જ ત્યારી બને તો શું પરિષ્ણામ આવે?

પ્રશ્ન ખોટી પરિકલ્પના ઉપર આધારિત છે. જો બધા જ સીઁઓ વાંગલી હોય, જો બધા જ વડીલ કે ડોક્ટર લુંટારા હોય તો હુનિયાનું શું થાય તેના જેવો આ વાહિયાત પ્રશ્ન છે. જેમની પાસે આધ્યાત્મિક સંસ્કારની સંપત્તિ જેગા થઈ હોય તેવી બહુ ઓછી વ્યક્તિઓ વૈરાગ્ય અને ત્યાગ અપનાવી શકે છે.

સંત આખા જગતને પવિત્ર બનાવે છે. તે સ્વાર્થ હોઈ જ ન શકે. શંકર, રામાનુજ અને બીજા સંતોએ સમસ્ત માનવજ્ઞત માટે કાર્ય કર્યું. જે સંતો એકાંતવાસી હોય અથવા ગુપ્ત વેશમાં હોય તેઓ પોતાના વૈચારિક પ્રવાહોથી જગત પર અસર પાડી શકે છે. આધ્યાત્મિક પથ પરનો નવો માણસ પણ તેના શુદ્ધ વિચારો દ્વારા હુનિયાનું ઘણું ભલું કરી શકે છે. સંતો અને સંત જેવા માનવોનાં વર્તન તેમજ તેમની પ્રવૃત્તિઓ અપવિત્ર મનવાળી વ્યક્તિસમજ શકતી નથી.

મોકા માટે સમ્યકું દાખિ જોઈએ. હું ખૂબ જૂનવાણી માનસવાળો છું અને અસ્પૃશ્યતામાં પૂર્ણ રીતે માનું છું. કોઈ અસ્પૃશ્ય કે હરિજનને હું છેટેથી જોઉં છું તો પણ તરત જ સ્નાન કરી કપડાં ધોઈ નાખું છું. આ નિયમો પાળવા જોઈએ?

ઈશ્વરને એવી પ્રાર્થના કરો કે તે એવો દિવસ તમને દેખાડે જ્યારે તમે એકત્વભાવથી પ્રેમપૂર્વક જાહુ વાળનાર હરિજનને લેટી પડો. આ તમારા માટે ધન્ય દિવસ હશે. તમારું દુદ્ય ખૂબ સાંકું સંકુચિત છે. તેને વિશાળ બનાવવા પ્રયત્ન કરો. ‘અસ્પૃશ્યતા’ને છોડી દો. તે તમારી આધ્યાત્મિક પ્રગતિમાં ખૂબ બાધારૂપ છે. તમારામાં ‘અસ્પૃશ્યતા’નાં મૂળ એટલાં ઊડાં ઊતરેલાં છે કે તેને દૂર કરતાં લાંબો સમય લાગશે. આ જ કણો માનવ માનવને જુદા પાડતા અંતરાયને કઠોર થઈ દૂર કરો. તમને અવર્ગનીય આનંદ અને પરમ શાંતિ પ્રાપ્ત થશે.

‘મારા પ્રત્યુત્તર’ માંથી સાલાર

## ગોળ અને ખાંડમાં શું ફર છે ?

આયુર્વેદમાં લઘું છે કે શરીરને ભોજનમાંથી મળવાવાળી જે સાકર છે તે ઝડપથી પેટમાં પણ તેમાં રસ્તામાં કોઈ ખલેલ ન પડે. એવી કોઈ વસ્તુ ભોજનમાં ના હોવી જોઈએ, જે પાચનકિયાને રોકે....

આપણા દેશમાં એક ખૂબ જ મોટી લેબોરેટરી છે, જેનું નામ CDRI (Central Drug Research Institute) છે. રાજ્યવભાઈ ત્યાં ગયા, વૈજ્ઞાનિકો સાથે વાત કરી કે તમે જણાવો કે ભોજનમાં એવી કઈ કઈ વસ્તુ છે, જે આપણા ભોજનની કુદરતી સાકરને શરીર માટે મદદરૂપ થવામાં અહયશરૂપ થાય છે તો બધા વૈજ્ઞાનિકોએ એક જ અવાજે જે વસ્તુનું નામ લીધું હતું તેનું નામ ખાડ હતું.

તેની જગ્યાએ શું ખાઈએ?

જવાબ છે—ગોળ

ગોળ અને ખાંડમાં ફરક !

બન્નેમાં ઘણો ફરક છે, ખાંડ બનાવવા માટે શેરરીના રસમાં રઉ જેર (કેમિકલ) ભેણવવાં પડે છે અને તે બધાં શરીરની અંદર તો જાય છે, પરંતુ બહાર નથી નીકળી શકતાં અને ગોળ એક જ એવો છે, જે કોઈ પણ જેર ભણ્યા સિવાય સીધેસીધો બને છે. શેરરીના રસને ગરમ કરતાં જીઓ, ગોળ બની જાય છે, તેમાં કઈ પણ ભેણવવું પડતું નથી. માત્ર તેમાં દૂધ ભેણવવાનું છે બીજું કઈ ભેણવવાનું નથી.

ગોળથી પણ સારી વસ્તુ તમે ખાઈ શકો છો, તેનું નામ છે - કાકવી. જો તમે ક્યારેય ગોળ બનતાં જોયો હશે તો ખબર પડી જશે. આ કાકવી ગોળથી પણ સારી છે, કાકવીને તેલમાં ભરીને રાખો તે ખરાબ થતી નથી, એક વર્ષ આરામથી રાખી શકો છો. કાકવીનો ભાવ પણ ગોળ જેટલો જ હોય છે. હવે તમે કાકવી ખાવ નહીં તો ગોળ ખાવ. જો તમને કાકવી મળી રહે છે તો સમજ લો કે તમે રાજ છો, જો કાકવી ન મળે તો ગોળ મળી રહ્યો છે તો નાના રાજ છો.

ખાડે આખી દુનિયાનો સત્યાનાશ કરી નાખ્યો છે. જ્યારથી ખાંડ બનાવવાનું અને ખાવાનું શરૂ કર્યું છે ત્યારથી સૌના શરીરની હાલત ખરાબ છે.

ભારતને છોડી દુનિયાના દેશોમાં ગોળ અને કાકવીની ખૂબ જ માગ છે, કેમ કે ખાંડથી બનેલી મીઠાઈ જલ્દી ખરાબ થઈ જાય છે, તેમાં ગુણવત્તા હોતી નથી, પરંતુ ગોળમાંથી બનેલી મીઠાઈ ઘણા મહિના સુધી બગડતી નથી અને સારી કલોલિટીની હોય છે. તમને સાંભળીને નવાઈ લાગશે કે ગામમાં ગોળનો ભાવ ત૦-૪૦ રૂપિયે કિલો હોય છે, પરંતુ ઈજારાઈલમાં ગોળ ૧૭૦ રૂપિયે કિલો વેગાય છે. જર્મનીમાં ગોળનો ભાવ ૨૧૦ રૂપિયે કિલો છે, કેનેડામાં ભારતના દુનિયાના હિસાબે ગોળનો ભાવ ત૩૦ રૂપિયે કિલો છે. આ બધા દેશોમાં ગોળની ખૂબ જ માગ છે. ખાંડ ત્યાં સર્સી છે, કેમ કે તેમને ખબર છે કે ખાંડ તેર છે અને ગોળ અમૃત છે.

જો ખાંડ તમે ખાધી તો તેને પચાવવી પડે છે અને તેમાં એટલાં નુકસાનકારક તત્ત્વો હોય છે કે આસાનીથી પચતાં નથી. જો ગોળ ખાશો તો ગોળ એટલી સરસ જાત છે કે જે પણ ગોળ સાથે તમે ખાધું છે, તેને ગોળ પચાવી દે છે.

ગોળ ભોજનને માત્ર ૪ કલાક ૪૦ મિનિટમાં પચાવી દે છે. એટલા માટે ભોજન સાથે ગોળ જરૂર ખાવ અને ખાંડ બિલકુલ ન ખાઓ.

આ સૂત્રનું પાલન કરશો તો ડાયાબિટીસ, આશ્રીટિસ, અસ્થમા, ઓસ્ટિયોપોરોસીસ જેવી ૧૪૮ ગંભીર બીમારીઓ જિંદગીમાં કાયારેય નહિ આવે. તમે તમારી જિંદગીમાંથી ખાંડને કાઢી નાખો, કેમ કે આપણને કુદરતી ખાંડ ફળમાંથી કે બીજી વસ્તુઓમાંથી મળી જ રહે છે, આ ખાંડ તમને પચવાના રસ્તામાં મોટી અહયા છે.

તમે એક વાત યાદ રાખો. જો ત્યાગવાની કોઈ વસ્તુ છે ને સૌથી વધુ નફરત કરવી છે તો ખાંડથી કરો.

ગોળ ખાઓ કાકવી ખાઓ.

ખાંડની આપણે ચીન વગેરે દેશમાંથી આયાત કરવી પડે છે. જ્યારે ગોળ આપણાં પોતાના દેશની પ્રોડક્ટ છે... તેને ભોજનમાં વિશેષ રથાન આપીએ... દેશને આર્થિક રીતે પણ સમૃદ્ધ કરીએ.

## વृतांत

- તા. ૬-૧-૨૦૨૧-તરબ (વીસનગર) : શિવધામ, શ્રી વાળીનાથજી અખાડાના આદરણીય અનંત વિભૂષિત શ્રી શ્રી ૧૦૦૮ બ્રહ્મલીન મહંતશ્રી બળદેવગિરિજી ગુરુશ્રી સુરજગિરિજી મહારાજની મહાસમાપિનાં પૂજન અને ઘોડશી ભંડારાનું ભવ્ય આયોજન તા. ૬-૧-૨૦૨૧ના રોજ થયું. બ્રહ્મલીન સ્વામીજીને પૂજય શ્રી સ્વામી અધ્યાત્માનંદજી મહારાજ સાથે ખૂબ જ સેનેટ હતો. તેઓ શિવાનંદ આશ્રમ દ્વારા આયોજિત તમામ સમારોહ અને સાધુ મીતિ લોજ-ભંડારાઓમાં પદ્ધારતા અને આશ્રમને પાવન કરતા તથા આશીર્વાદ આપત્તા.
- આ પ્રસંગે પૂજય સ્વામી અધ્યાત્માનંદજી મહારાજને ઘોડશી ભંડારામાં વિશેષ આમંત્રણ હતું. નૂતન નિવાચિત મહંતશ્રી જ્યારામગિરિજી મહારાજની ચાદરવિષિ પણ હતી. આ પ્રસંગે દેશ-પરક્રદેશથી એક લાખથી વધુ ભક્તોનો મહેરામણ ઉમટ્યો હતો. ૩૦,૦૦૦થી વધુ સાધુ-સંતોની ઉપસ્થિતિ હતી. બ્રહ્મલીન મહંતશ્રી બળદેવગિરિજી મહારાજને માત્ર બાર વર્ષની ઉમરે જ ગાડી પર બેસાડવામાં આવ્યા હતા. તેઓ ૧૦૩ વર્ષનું આયુષ્ય ભોગવીને ૮૧ વર્ષ સુધી મહંતપદ બિરાજ મહાસમાપિ લીધી, જે તેમના જીવનની પવિત્રતાના સુંગધનનું એક અદ્ભુત ઉદાહરણ હતું.
- તા. ૬-૧-૨૦૨૧ - અમદાવાદ : શ્રીમતી. રૂપા મનીશ મજમુદાર આશ્રમનાં સહમંત્રી છે. રેઈકી ગ્રાન્ડ માસ્ટર છે, તથા 'દિવ્ય જીવન' માસિકનાં સંપાદિકા પણ છે. સાડા નવ મહિનાના અંતચલ પછી ફરી શિવાનંદ આશ્રમમાં તેમના રેઈકી વર્ગોની તા. ૬-૧-૨૦૨૧ના રોજથી પ્રારંભ થયા. અત્યાર સુધીમાં દેશ-વિદેશના ૧૫,૦૦૦થી વધુ મુખ્યાઓએ રેઈકીની ફર્સ્ટ અને સેક્ન્ડ ડિગ્રીનું પ્રશિક્ષણ તેમની પાસે લીધું છે.
- તા. ૧૨-૧-૨૦૨૧ - મહેસાણા : શ્રી પંચદશાનામ નિરંજનાં અખાડાના મહંત ૧૦૦૮ અનંતશ્રી વિલુષ્ટિત પૂજય શ્રીયરણ શ્રીમત્ સ્વામી શિવનાથપુરીજી ભીમનાથ મહાદેવ પરા (મહેસાણા)ના મહારાજનો ઘોડશી ભંડારો તા. ૧૨-૧-૨૦૨૧ના રોજ મહેસાણા ખાતે આયોજાયો. પૂજય સ્વામી અધ્યાત્માનંદજી મહારાજને પણ ઘોડશી પૂજાર્થે નિમંત્રવામાં આવ્યા હતા. મહેસાણાથી પાછા ફરતાં પૂજય સ્વામીજી શિવાનંદ આશ્રમના જૂના સંત શ્રી સ્વામી નિશ્ચલાનંદજી મહારાજનાં દર્શને ખડકા-દવાડાનાં તેમનાં એકાત નિવાસ આશ્રમમાં જઈને આશ્રમ પાક્ષ પદ્ધાર્યા.
- તા. ૧૪-૧-૨૦૨૧ - શ્રી રામનગર કુપા(ખેડગ્રામ) - અંબાજી : બ્રહ્મલીન પૂજયપાદ શ્રીમત્ સ્વામી ગુરુહૃપાનંદજી મહારાજના પૂર્વક્ષમનાં પરિજ્ઞનો દ્વારા પ્રતિવર્ષ મકરસક્ષાન્તિ પર્વે ગો-પૂજન-સત્સંગનો કાર્યક્રમ રાજવામાં આવે છે. અમદાવાદ-શિવાનંદ આશ્રમનું એક ભક્ત મંડળ આ વર્ષે પણ આ ઉત્સવમાં ઉપસ્થિત રહ્યું. આડોસ - પાડોસનાં ગામની આશરે રેપો ગાયોને ઊભી જેતી - પાક ખવડાવવામાં આવ્યો. પૂજય સ્વામીજીએ ગો પૂજન કર્યું. સત્સંગ પણી, મહાપ્રસાદ ગ્રહણ કરી. સૌ અંબાજીનાં દર્શને ગયા. સાંજના ૭.૩૦ વાગ્યે સૌ શિવાનંદ આશ્રમ, અમદાવાદ ખાતે પાછાં ફર્યા.
- તા. ૧૮-૧-૨૦૨૧ - અમદાવાદ : પૂજયપાદ શ્રીમત્ સ્વામી અધ્યાત્માનંદજી મહારાજની નિશ્ચામાં ૮૧૪મો યોગાસન, પ્રાણાયામ, ધ્યાન શિખિર આયોજાયો. આ જીનસત્રનું દીપ મજજુવલન આશ્રમના વયોવૃદ્ધ સ્વામી શ્રી કમલાનંદજી મહારાજે કર્યું. COVID-19 માટેની સૂચનાઓને ધ્યાનમાં રાખી પ્રત્યેક યોગપ્રેમીને આઈ-આઈ ફૂટના અંતરે બેસાડવામાં આવ્યા અને સંખ્યા પણ મધ્યાદિત જ લેવામાં આવી. આ જીનસત્રનું સમાપન તા. ૨૭-૧-૨૦૨૧ના રોજ થયું.
- સુપ્રસિદ્ધ યુવા કથાકાર શ્રી જિંદેશદાદાજીની વ્યાસપાઠ શિવાનંદ આશ્રમમાં શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન થયું, જેમાં પણ ખૂબ જ મધ્યાદિત ભક્તોની social distancing સાથે બેઠક વ્યવસ્થા કરવામાં આવી. પૂજય સ્વામીજી દરરોજ સાંજે કથામાં ઉપસ્થિત રહ્યા.
- તા. ૨૧-૧-૨૦૨૧થી તા. ૩-૨-૨૦૨૧ અમદાવાદ : શ્રી શ્રી મા આનંદમધી સંધના સર્વોચ્ચ પ્રધાનાધ્યક્ષ પૂજયપાદ શ્રીમત્ સ્વામી અચ્યુતાનંદજી મહારાજે શિવાનંદ આશ્રમમાં નિશ્ચા કરી સૌને ધર્મલાલ આય્યો. તેમનું વય ૮૫ વર્ષનું છે. પૂજય સ્વામી અધ્યાત્માનંદજી પ્રત્યેના ભાવ અને પ્રેમ થકી દર વર્ષે તેઓ અમદાવાદ પદ્ધારે છે.
- તા. ૨૬-૧-૨૦૨૧ - અમદાવાદ : આજે ગણાત્મક હિવસ હોઈ આશ્રમમાં પૂજય સ્વામીજીએ ધ્યજવંદન કર્યું. દેશ પત્રે વફાદારી, રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્ર જ પહેલાં, રાષ્ટ્રનાં હિતમાં જ આપણું હિત-ની વાત કરી.
- સવારે ૮.૦૦ થી મધ્યાહ્ન બાર વાગ્યા સુધી મારુતિ પણ થયો. સાંજે દિલ્હીના સુપ્રસિદ્ધ રામાયણી શાલ્લેય શ્રી અજ્ય યાશ્રીકણ દ્વારા સંગીતમય સુંદરકંડ પારાયણ થયું.



# શુદ્ધતા અને અતુટ વિશ્વાસની પરંપરા

**SUVARNAKALA®**

Gold, Diamond, Jadtar & Silver Jewellery

BIS Approved Jeweller

## અમદાવાદ

મહેનગર : TGB બેકરીની સામે,  
મહેનગર ચાર રસ્તા  
+91 63 5600 2200

સી.જી.રોડ : નેશનલ પ્લાઝા,  
લાલ બંગલોની સામે  
+91 99 2490 2223

સેટેલાઈટ : વિનસ અમેરીયસ,  
BRTS જોખપુર ચાર રસ્તા  
+91 97 1400 8200





# સ્વાદ અને ગુણવત્તાની પરંપરા



શ્રેષ્ઠ ગુણવત્તાની પરંપરા દ્વારા દેશ-વિદેશના અસંખ્ય ગ્રાહકો સુધી પહોંચવાનો અમારો નિર્ધાર છે.  
ભારતીયતાનું સ્વાદ સભર ગૌરવ!



મસાલા • ઈન્સ્ટન્ટ મિક્સ • બ્લેન્ડેડ મસાલા • હિંગ વગેરેની વિશાળ શ્રેણી અને પેક સાઈઝ



રામદેવ કૂડ પ્રોડક્ટ્સ પ્રા. લિ.

સ્થાનિક વર્કસ, સરબેજ-બાવળા હાઇવે, ચાંગોડા-ઢાર ૨૧૩, અમદાવાદ. • [www.ramdevfood.com](http://www.ramdevfood.com)





કર્ષાવતી મહાનગરીનાં આધુકુળદેવી મા ભદ્રકાળીનાં  
નિજમંદિરમાં પૂજયશી સ્વામી અધ્યાત્માનંદજી મહારાજ  
દ્વારા નિરાજનમ્. તા. ૩૦-૧-૨૦૨૧



શ્રીશ્રીમા આનંદમયી સંઘના પરમાધ્યક્ષ પૂજ્યપાદ  
શ્રીમતુ સ્વામી અચ્યુતાનંદજી મહારાજશ્રીની શિવાનંદ આશ્રમમાં  
નિશા-ધર્મલાભ. તા. ૨૧-૧-૨૦૨૧ થી ૩-૨-૨૦૨૧



શ્રી પંચદશનામ નિરંજની અખાડાના નૂતન મહૃતશ્રી  
પ્રકાશ પુરીજીની ચાદર વિવિ. (શ્રી ભીમનાથ મહાદેવ  
પરા- મહેસાણા) તા. ૧૨-૧-૨૦૨૧



‘સ્વાસ્થ્ય’ સંસ્થા દ્વારા Online આયોજિત ડાયાબિટીસ કોન્ફરન્સ  
(૨૦,૦૦૦ પાર્ટીસિપન્ટ્સ)નું પૂજ્ય સ્વામી અધ્યાત્માનંદજી મહારાજ દ્વારા  
દિપ પ્રજ્વલન - ઉદ્ઘાટન, અમદાવાદ. તા. ૧૮-૧-૨૦૨૧



શિવાનંદ આશ્રમમાં શ્રીમદ્ ભાગવત કथા તા. ૨૪-૧-૨૦૨૧ અને શ્રી સુંદરકંડ પારાયણ. તા. ૨૬-૧-૨૦૨૧ (અમદાવાદ)  
૩૫





શિવાનંદ આશ્રમનાં ભક્ત વૃંટે મોટાં અંબાજીનાં દર્શન તથા  
શ્રી રામપુર કંપે - ગોપૂજન સત્સંગનો લાભ લીધો. તા. ૨૬-૧-૨૦૨૧



ડૉ. વિનુભાઈ - સંપાદિત પુસ્તક 'જીવન જીવી જીણો'નું  
શિવાનંદ આશ્રમમાં લોકાર્પણ તા. ૨૬-૧-૨૦૨૧



શિવાનંદ આશ્રમ ખાતે રેઇકી પઢોમો ફસ્ટ ડિગ્રી સેમિનાર. તા. ૮-૧-૨૦૨૧



શ્રી નારાયણ સૈવા. તા. ૮-૧-૨૦૨૧

## શિષ્ય

'શિષ્ય' એટલે શું ? 'શિષ્ય' કોને કહેવાય ? જે ગુરુના માર્ગદર્શન મુજબ ચાલે, તેમના ઉપદેશ મુજબ પોતાની જીતને ઘડવા પ્રયત્ન કરે અને સદ્ગુરુ જે સૂચનો આપે તે પ્રમાણે જીવવા અને વર્તવા યત્ન કરે તે શિષ્ય. આવું શિષ્યત્વ તમને વિકાસના રાહ પર ચડાવી આત્મસાક્ષાત્કારના મહાન અનુભવ તરફ લઈ જશે.

- સ્વામી ચિદાનંદ